

સંપ્રદાયનો સર્વાંગી વિકાસ કરું શ્રી સ્વા. મંદિર - સરધારનું મુખ્યપત્ર

# સ્વામિનારાયણ ચિંતન

નવેમ્બર - ૨૦૧૫

બે વર્ષ લયાજમ રૂ.૧૫૦/-

## ૨૦મી સત્સંગ છાવણી - સરધાર



ભગવાન શ્રી સ્વામિનારાયણનું મહાન પ્રસાદીભૂત તીર્થધામ સરધામને આંગણે ઉજવાયો  
શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી - વિંશાબ્દી મહૌઠસવ - ૨૦૧૫



તીર્થધામ સરધારને અંગળે પ.પુ. પ.ધુ. આચાર્ય મહારાજશ્રીના રૂપ આશીર્વાદ સહ આશાથી પ. પુ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી વૃગેન્ડ્રપ્રસાદજીના દિવ્ય સાતિથમાં  
પુ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યરસ્વરૂપદાસજીના માર્ગદર્શન પ્રમાણે યોજાયેલ રૂમી 'શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી' (તા. ૮ વી ૧૭-૧૧-૨૦૧૫)

૧. સભામંચમાં પથારતા પ.પુ. લાલજી મહારાજશ્રી. ૨. પ.પુ. લાલજી મહારાજશ્રીનું સ્વાગત કરતા પુ. સ્વામી. ૩. સ્વાગત ગૃહી દ્વારા પ.પુ. લાલજી  
મહારાજશ્રીનું સ્વાગતપૂજન કરતા સરધાર મંદિર છાગાલયના વિદ્યાર્થીઓ. ૪. સભામાં ઉપસ્થિત પુ. સંતો. ૫. સત્સંગ છાવણીની પ્રારંભ શોભાયાના. ૬.  
અંધકારનો પ્રારંભ કરાવતા પુ. સ્વામી આદિક સંતો. ૭-૮. શાનગોષ્ઠી. ૯-૧૦. દીપાવલી શારદા-ચોપડા પૂજન. ૧. આરતીનો વાભ વેતા યજમાનશ્રીઓ.



તીર્થધામ સરધારને આંગણે પ.પૂ. ધ.ধુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આશાથી પ. પૂ. ૧૦૮ શ્રી ભાવિલાચાર્ય શ્રી નૃગોદ્ધ્રાદજીના દિવ્ય સાચિથમાં  
પૂ. સ.ગુ. સ્વામી શ્રી ગિત્યાખણ્દાસજીના માર્ગદર્શન પ્રમાણે યોજાયેલ ૨૦મી 'શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી' (તા. ૮ થી ૧૭-૧૧-૨૦૧૫)

૧. નૂતન વર્ષના મંગળ પ્રભાતે દાકોરજી તથા પ.પૂ આચાર્ય મહારાજશ્રીનું પૂજનઅર્યનું કરી આરતી ઉત્તારતા પૂ. સ્વામી. ૨. નૂતન વર્ષ પ્રારંભ સભામાં પૂ. સંતો.  
૩. થી ૭. પૂ. સંતો-પાર્ષ્ઠી અને હરિભક્તોનું પરસ્પર પૂજન દર્શન. ૮. શ્રી સ્વા.મંહિર (જૂન)માં બિરાજમાન દાકોરજી સમક્ષ પૂ. સંતો દ્વારા તૈયાર થયેલ ઇઘ્યનભોગ  
અન્નકૂટ. ૯. સંતો-હરિભક્તોનો રાસોત્સવ. ૧૦. સમૂહ આરતી દર્શન.



મહાન તીર્થધામ ગાડાને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના દિવ્ય સાનિધ્યમાં પ.ભ. શ્રી વિપુલભાઈ બટુકભાઈ માંગુકીયાના યજમાનપદે ઉજવાયેલ ભગવાન શ્રીહરિ સ્થાપિત શ્રી ગોપીનાથજી મહારાજ આદિક દેવોનો '૧૮૬મો વાર્ષિક પાટોસવ' તેમજ શ્રી ગોપીનાથજી વહીવટી બાર્ડની નૂતન ઓફિસનું ઉદ્ઘાટન કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. (તા. ૨૪-૧૦-૨૦૧૫)



ગટપુરને આંગણે ગટપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.કુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ સહ આશાથી સમગ્ર ધર્મકુળ પરીવારના દિવ્ય સાનિધ્યમાં ઉજવાયેલ 'દીપાવલી-નૂતન વર્ષ અક્ષકૂટ મહોત્સવ' તથા 'ભક્ત રિંતામણી કથા પારાયાણ' (તા. ૧૧ થી ૧૭-૧૧-૧૫)



### શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્થ શ્રી લક્ષ્મીનારાયણ દેવ  
પીઠસ્થાન સંસ્થાન - વડતાલ વતી

**શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર**  
તા.જી. રાજકોટ - ઉ૬૦૦૨૫.

પ્રકાશક/માલિક/તંત્રી :- સાધુ પતિતપાવનદાસજી  
સંપાદક :- સ્વામી આનંદસ્વરૂપદાસજી (વેદાંતાચાર્ય)

સંકલન : સાધુ અમૃતસ્વરૂપદાસજી  
ગુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

લવાજમ દર અંગે ગ્રાહક પત્ર વ્યવહાર :-

### ચિંતન કાર્યાલય

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર,  
તા.જી. રાજકોટ - ઉ૬૦૦૨૫. ફો.નં. ૦૨૮૧ - ૨૭૮૧૨૧૧

[www.sardharkatha.com](http://www.sardharkatha.com), [www.svg.org](http://www.svg.org)

Email : sardharmandir@gmail.com

**લવાજમ દર :-**

બે વર્ષ : રૂ. ૧૬૦/-, પંચવાર્ષિક : રૂ. ૩૫૦/-, પચ્ચીસ વર્ષ : રૂ. ૭૫૦/-  
પરદેશમાં લવાજમ : \$ 200 U.S.A. £ 125 U.K.



Online : [www.lakshyatv.com](http://www.lakshyatv.com)

પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિચાર્ય  
શ્રી નૃગોપ્રસાદજી મહારાજાની  
**દિલ્ય અમૃતવાણી**

સમય : દરરોજ

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥  
સંપ્રદાયનો સર્વાંગી વિકાસ કરતું શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધારનું  
રજિસ્ટર્ડ મુખ્પત્ર ઈ.સ. ૨૦૦૫ના જૂન માસથી પ્રારંભાયેલું, દર માસની ૨૦ તારીખે  
પ્રકાશિત થતું, આપના સમગ્ર કુટુંબ-પરિવારમાં આનંદ અને સંસ્કારની સૌભાગ્ય  
પ્રસારાએ અને જીવનનું અનેંદ્ર ધરતર કરતું સામયિક.

# સ્વામિનારાયણ ચિંતન

વર્ષ : ૩, અંક : ૧૦, તા. ૨૦-૧૧-૧૫

પ્રયોજક :- પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

## અમૃતવાણી

"...સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો  
આ સત્સંગનો પ્રતાપ એવો છે જે, જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને  
નિવૃત્તિ થઈ જાય છે અને નિરૂત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું  
ચિંતવન થાય છે. અને સત્સંગ વિના તો બીજા કોટિ સાધન કરે પણ તેને  
ઘાટની તથા રજોગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહિ અને જો  
નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ  
મલિન ઘાટનો નાશ થાય છે, માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે;  
અને બીજાં સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહિ, કંઝે કોઈ સાધને  
કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે, તે  
કારણાપણા. માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન-  
કુર્મ-વચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની  
નિવૃત્તિ થઈ જશે..."

(ભગવાન શ્રી સ્વામિનારાયણ - વચ્ચ.પ્ર. ૩૦)

## અનુક્રમણિકા

૧. સત્સંગનો ચંદ્રવો એટલે સત્સંગ છાવણી ૦૬

૨. શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી - વિંશાણી મહોત્સવ - ૨૦૧૫ ૧૨

૩. સત્સંગ સમાચાર પત્રિકા ૨૧

પૂ. સ.ગુ. શ્રી નિત્યસ્વરૂપદાસજીના  
સત્સંગ શ્રીમુખે

કથા પારાયણ

સમય : દરરોજ રાત્રે ૮.૦૦ થી ૧૧.૦૦

પૂ. સ્વામી શ્રી પૂર્ણસ્વરૂપદાસજીના શ્રીમુખે

સત્સંગ કથાગુણ

સમય : દરરોજ સવારે ૫.૩૦ થી ૭.૩૦



# સત્સંગનો ચંદરવો એટલે સત્સંગ છાવણી

સાધુ અમૃતસ્વરૂપદાસજી તથા શા. શ્રી રવિન્દ્રભાઈ જોધી

સંપ્રદાયના મહાન સમાટ ગ્રંથ ‘શ્રી સત્સંગિજીવન’માં સ.ગુ. શ્રી શતાનંદ સ્વામી ‘સત્સંગ’ શબ્દનો અર્થ શ્રીમુખ વચનોથી જણાવે છે : “સત્ત એવા ભગવાન, તેમના દ્વારા પ્રસ્થાપિત થયેલ ભાગવતધર્મ, તેઓશ્રીએ પ્રવતર્વેલ શાસ્ત્રો અને તે ત્રણોનું ભક્તિપૂર્વક પાલન-ઉદ્ભોધનાટિથી સંપોષણ કરતા એવા સાધુપુરુષો - આ ચારેય સત્ય સ્વરૂપનો સંગ તે ‘સત્સંગ’ એમ જણાવેલું છે.”

સત્સંગ એટલે સર્વશ્રેષ્ઠની જાણકારી મેળવવી ને શ્રેષ્ઠને પામવું. સત્સંગ છોડાવે છે બંધનથી. સત્સંગથી સંસારનું ગુરુત્વાકર્ષણ બળ ઘટે છે ને સત્સંગથી સંસારથી બહાર નીકળી જતા, લેવિટેશન બળ તેને ખેંચે છે, સત્સંગની ઉજ્જાશકિત વધતાં, તેની ઊર્ધ્વગતિ એટલે કે મહાપ્રભુ શ્રીહરિ તરફ ગતિ થાય છે ને પરમનું લક્ષ્ય સિદ્ધ થાય છે. ચિત્તથી ચૈતન્ય ને આત્માથી પરમાત્મા સુધી સત્સંગ દોરી જાય છે. શુકુદ્વારા મહારાજે રાજા પરીક્ષિતને તેમના જીવનમાં છેલ્લા સાત દિવસ દરમ્યાન શ્રીમદ્ ભાગવત કથા સંભળાવી પરિણામે રાજા પરીક્ષિત પરમાત્માના ધામમાં ગયા.

સામાન્ય રીતે આપણે સત્સંગના બે વિભાગોમાં સમજીએ તો એક ક્ષણિક અને બીજો સ્થિર. આપણે જ્યારે કોઈ તીર્થસ્થળોમાં



યાત્રાએ જઈએ છીએ ત્યારે તે તે સ્થળોએ વસતા મહાપુરૂષો કે સંતો અથવા ભગવદ્ ભક્તોના સંપર્કમાં આવીએ છીએ. તેમજ જે તે સ્થળોએ નક્કી કરેલા સમય માટેની કથાપારાયણો કે મહોત્સવો વગેરે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને પ્રબન્ધિત વિદ્વાન સંતો-મહાપુરૂષો દ્વારા ભક્તિમાર્ગીય મધુરવાણીનું શ્રવણ કરીએ છીએ. આ પ્રકારનો સત્સંગ પ્રાસાંગિક સ્થિર સત્સંગ કહીએ. પરંતુ આપણે જ્યારે નિયમિત સત્સંગ કરવાના ઉદ્દેશથી મંદિરમાં અથવા તો સત્સંગ સભાઓમાં જઈએ છીએ ત્યારે કમે ક્રમે અલોકિક માર્ગદર્શનથી સત્સંગનું પરિણામ નવું જ રૂપ ધારણ કરે છે કે જેને આપણે સ્થિર ને સ્થાયી સત્સંગ કહીએ. આ પ્રકારના સત્સંગથી પૂર્ણ ભક્તિ, શરણાગતિ અને સ્વાર્પણની ભાવના પ્રકટ થાય છે.

માનવજીવનના આધ્યાત્મિક વિકાસ માટે 'સત્સંગ' એ મુખ્ય ને સૌથી અગત્યનું સાધન છે. પરંતુ સત્સંગ સફળ થઈ આત્મનિરીક્ષણ અને પરમાત્માદર્શનમાં પરિણામશે કે નિષ્ફળ થઈ ફળહીન બનશે તેનો આધાર તો જીવાત્માની ભાવના, ઉત્કંઠા, તીવ્ર ઝંખના તેમજ ગ્રહણ કરવાની વૃત્તિ પર જ અવલંબિત હોય છે. આપણે જે ભાવનાથી સત્સંગમાં જઈએ છીએ, તે ભાવના અનુસાર જ તેની ફળપ્રાપ્તિ થાય છે.

સત્સંગ એ કલ્યાણકારી સકળ સાધનોમાં શ્રેષ્ઠતમ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગથી જ્ઞાન પ્રકટે છે અને અજ્ઞાન નાટ થાય છે. સત્સંગથી સુખુદ્ધિ આવે છે અને દુખુદ્ધિ જાય છે. સત્સંગથી કાળ, કર્મ અને માયા જીતાય છે અને સુખસિન્હુ સર્વેશ્વર ભગવાનને ભેટાય છે.

અંધકારમાં અથડાતા મનુષ્યને જ્યારે દીપકનો સંબંધ થાય છે ત્યારે તેનો અંધકાર ટળે છે. ભીંતે ભીતે ભટકાવું બંધ થાય છે

અને દરેક પદાર્થ દશ્યમાન થાય છે. પણ એ દીવો થાય છે ક્યારે ? તો જ્યારે કોડિયું, વાટ, તેવ અને અજિન - આ ચારનો સંબંધ થાય છે ત્યારે. તેમ અનંતકાળથી અજ્ઞાનરૂપ અંધકારમાં અથડાતા જીવોને પણ જ્યારે જ્ઞાનદીપકનો સંબંધ થાય છે ત્યારે તેમનું અજ્ઞાન ધ્વાન ટરો છે. ભવાટવીનું ભ્રમણ બંધ થાય છે અને સત્ત્યાસત્ત્યનું જ્ઞાન થાય છે. પરંતુ એ જ્ઞાનદીપક થાય છે ક્યારે ? તો જ્યારે ઉપરોક્ત મુજબ સત્તુએવા ભગવાન, તેમના દ્વારા પ્રસ્તાપિત થયેલ ભાગવતધર્મ, તેઓશ્રીએ પ્રવર્તિવેલ શાસ્ત્રો અને તે ત્રૈનેનું ભક્તિપૂર્વક પાલન-ઉદ્ભોધનાદિથી સંપોષણ કરતા એવા સાધુપુરુષો - આ ચારનો સંબંધ થાય છે ત્યારે. માટે દરેક મોક્ષઅભિલાષી, રાગી, ત્યાગી, સ્ત્રી-પુરુષોએ આ ચારનો જ અખંડ સંબંધ રાખવો અને હંમેશા તન-મન અને શુદ્ધ ભાવથી આ ચારનું સેવન કરવું.

પરંતુ 'અનાદિકાલતો જીવો માયા પરિવેચ્છિત' ।' અનંતકાળથી આ જીવ માયાવેચિત છે. માયાનો આહારી, વિહારી અને માયાનો કીડો બની ગયો છે, તેથી જ તેમાં લુધ્ય થવું સારું લાગે છે. વળી તેનો અવળયંડો સ્વભાવ થઈ ગયો છે, જેથી કરી તેને સુખ ભોગવવું સારું લાગે છે, પણ સુખનું સાધન કરવું સારું લાગતું નથી પણ હુંખનું સાધન કરવું સારું લાગે છે. માટે હવે તો ડોળ-ડહાપણ કે પ્રવૃત્તિ માત્રનો ત્યાગ કરી માયાથી મુક્ત બની સ્વશ્રેષ્ઠ: સાધવા સત્તસંગ કરી લેવો.

**કાયિક એટલે ચોરી વ્યભિચાર,** હિંસાદિક પાપકર્મ કરવું. **વાચિક એટલે કોઈની નિંદા** કરવી, અસત્ય બોલવું કે કોઈને વાક્યભાગ મારવાં. અને માનસિક એટલે તૃપ્તિશારાખવી, વિષરૂપ વિષયનું ચિંતવન કરવું અને સર્વમાં દોષ કલ્પવો. આ ગ્રાણ જતના પાપકર્મનો ત્યાગ કરી ખરા ખપવાળા બની શુદ્ધ ભાવથી સત્તસંગ કરવો.

લવણને લીધે જ વંજનોનો સ્વાદ છે. એ વિના તો નીરસ નમાલા અને નિરૂપયોગી ને નિઃસ્વાદું છે, તેમ સત્તસંગને લીધે આલોક અને પરલોકનું સુખ મળે છે. સત્તસંગ સકળ સાધનોનું ફળભૂત છે. ભ્રાણદિક દેવતાઓને પણ તે દુર્લભ છે, અને સુખ, સંપત્તિ, શાંતિ, ક્રીતિ અને મુક્તિ આપનાર એક સત્તસંગ જ છે.

આંખ, ઉજાસ અને અરીસો - આ ત્રણ સિંવાય પોતાના મુખ પરનો ડાઘ જોઈ શકતો નથી; તેમ ગમે તેવો વિદ્બાન, વિવેકવાન, વિચારવાન અને વર્તમાનશાણી હોય, પણ સત્તસંગ વિના પોતાના દોષાદોપને જોઈ શકતો નથી. તેમ હદ્યમાંથી અનેક જન્મોના પાપોના થરો ઊખડી શકતા નથી. આ સત્તસંગને તો મોટા મોટા ભ્રાણદિક દેવતાઓ ઈચ્છે છે. આવા અત્યુત્તમ સત્તસંગને પામી જે મનુષ્ય પોતાનું શ્રેય સાધતો નથી તો તે અત્યંત શોચનીય, કમભાગી, મતિહીન, કૃતધ્ની અને નીચ્યે છે.

જેને કલ્યાણનો ખપ હોય તેને તો મોક્ષમાર્ગને વિષે

સાવધપણે રહેવું. પોતાનો મુક્તામ (ધર્મ) મૂકાય નહિ; નિશાન (ધ્યેય વસ્તુ પરમાત્મા) ચૂકાય નહિ અને નિર્દોષબુદ્ધિ, સંગશુદ્ધિ અને આહારશુદ્ધિ એ ખરોખર સાચવીને આને હેઠે છેલ્લો જન્મ સફળ કરવા સાચા ભાવે સત્તસંગ કરી લેવો જોઈએ.

એકવખત નેમિભારાણ્ય ક્ષેત્રમાં બ્રહ્મિષ્યાઓ, રાજ્યિષ્યાઓ, દેવર્ષિષ્યાઓ અને મુનિ મહામાઓ લેગા થયા. તેમાં એવો પ્રશ્ન ઊઠ્યો કે, સત્તસંગ તુલ્ય કોઈ સાધન છે કે નહિ ? તેનો નિર્ણય કરવા એક મોટી તુલા બાંધી. પછી એક પલ્લામાં સત્તસંગ મૂક્ત્યો, બીજા પલ્લામાં મૃત્યુલોકના સુખોત્પાદન સાધનો દયા, દાન, પરોપકાર, આદિ મૂક્ત્યા, પણ સત્તસંગવાળું પલ્લું ઊંચું થયું નહિ. ત્યારે તેને કાઢી ને તે પલ્લામાં સ્વર્ગલોકના સુખોત્પાદન સાધનો યજા-યાગાદિક મૂક્ત્યાં, તો પણ સત્તસંગવાળું પલ્લું ઊંચું થયું નહિ. ત્યારે સત્ત્યલોકના સુખોત્પાદક સાધનો જે સત્ય, તપ, યમ, નિયમ, બ્રહ્મયાર્થિક મૂક્ત્યાં, પણ સત્તસંગવાળું પલ્લું જરા પણ ઊંચું થયું નહિ. આ જોઈ તેઓ અત્યંત આશ્ર્ય પામ્યા. પછી તો મોક્ષના સકળ સાધન માત્ર મૂક્ત્યાં, તો પણ સત્તસંગવાળું પલ્લું એક તલભાર પણ ઊંચું થયું નહિ. આથી સર્વે સમજ અત્યંત આશ્ર્ય પામી ગયો. સત્તસંગ તુલ્ય ઉત્તમ સાધન કોઈ પણ નથી એમ નિશ્ચય કરી સર્વે લોકો એક સત્તસંગની પ્રશંસા કરવા લાગ્યા.

**ગોસ્વામી તુલસીદાસજી કહે છે :-**

'બિનુ સતસંગ ન હરિકથા, તેહિ બિનુ મોહ ન ભાગા; મોહ ગયે બિનુ રામપદ, હોઈ ન દટ અનુરાગા. તાત સ્વર્ગ અપવર્ગ સુખ, ધરીય તુલા ઈક અંગ; તૂલે ન તાહિ સકલ મિલી, જો સુખ લવ સતસંગ. ધન જોબન સુખ સંપત્તિ, અવિચન રહે ન કોય; જેતી ઘડી સતસંગકી, જુવનકા ફળ સોય. તેમજ સદ્ગુરુ સંતો કહે છે :-'

કર્મવશ કોટિ કાદ સહે, રહે રાત દિવસ રોસિવડો; પણ સતસંગમાં લેશ દુઃખ સહેતા, જાય છે એનો જુવડો. જયું જયું કરત સતસંગ, તયું શ્રદ્ધાદિક ગુન બટત; તેહિ ઉર ધર્મ અબંગ, બસત હે નિજ પરિવાર જુત.'

સ.ગુ. શ્રી બલાનંદ સ્વામી પણ કહે છે :- 'સત્તસંગ વિના, જન્મમરણ ભ્રમજ્ઞાન મટે નહિ જંતને; મન માન તજી, તે માટે શરણે જઈ રહીએ સંતને...'

પાણીથી શરીરનું સ્નાન થાય છે, ભક્તિથી મનનું સ્નાન થાય છે, જ્યારે સત્તસંગથી બુદ્ધિનું સ્નાન થાય છે. આ નિર્વેણી સ્નાનનું જીવનમાં બહુ મહત્વ છે. આપણને વરસાદથી પલળતા છત્રી કે રેઈનકોટ અટકાવે છે તેમ જમાનાના દૂધપણો અને દુર્ગુણોથી બગડતા આપણને સત્તસંગ અટકાવે છે.

સત્તસંગ તો સર્વિસ સ્ટેશન જેવો છે. જ્યાં ગાડીની અંદર રહેતી બધી ખરાબી દૂર થઈ જાય છે. તેમ સત્તસંગથી હદ્યની

મહિનતા દૂર થઈ જાય છે. હદય નિર્મળ બને છે અને હદયમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે. શરીરનો રોગ ઔષધ હરે છે તેમ મનનો રોગ સત્તસંગ હરે છે.

સંડાસનો લોટો ભલે ને નવો જ હોય પણ ક્યારેય ઉટકાતો ન હોય તેથી અમુક હિવેસ તે કઈ ધ્યાતુનો છે એની ખબર જ ન પડે પણ નિત્ય વપરાશના વાસણી કાયમ ઉટકાતાં હોય એટલે એમાં ફરી ફરીને જમતાનું મન થઈ જાય છે. તેમ જીવ નિત્ય સત્તસંગમાં ઉટકાતો રહેવો જોઈએ, તો જ જીવ સારો રહે. નિયમિત ધ્યાન, પ્રાર્થના, સ્મરણ, સ્વાધ્યાય અને સત્તસંગ વિના મન મેલું થઈ જાય છે.

ગાંડીતૂર બનેલી નદી સેંકડો ગામોનો ધંસ કરી નાખે છે તેમ નેકાલૂ યુવાની જીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખે છે. તોકાની નદી ઉપર બંધ બાંધવામાં આવે તો એ જ નદી હજારો ગામોને ‘સુજલામ સુફલામ’ બનાવી શકે છે. તેમ યુવાનીના ધસમસતા પ્રવાહ પર જો સત્તસંગનો બંધ બાંધવામાં આવે તો એ જ યુવા શક્તિ સમગ્ર જીવન સૃષ્ટિને નંદનવનમાં પલટાવી નાખવા સમર્થ થઈ શકે છે. પાણીને ઠંડું કરવું હોય તો ઝીજની જરૂર પડે. ઘરને ઠંડું કરવું હોય તો એ.સી.ની સ્વીચ્છા ચાલુ કરવી પડે તેમ હદયને ઠંડું કરવું હોય તો સત્તસંગની જરૂર પડે. જઠરાણિ કમજોર હોય તો ભોજન ભાવે નહિ અને હદયમાં લગની કમજોર હોય તો સત્તસંગ ભાવે નહિ. નિત્ય સત્તસંગ કરે ત્યારે જેમ મોલમાંથી ખડ નીટ છે તેમ હેયામાંથી ભગવાન વિના સર્વ કચરો નીકળી જાય છે. બહુ અંધારું હોય તો ફાનસની વાટ ચડાવવી પડે જેથી વધુ પ્રકાશ થાય તેમ હદયમાં દોષોનું અંધારું ધારું હોય તો સત્તસંગનો ડોગડબલ લેવો જોઈએ.

દૂધની સાથે ભળી ગયેલું પાણી દૂધને ભાવે વેચાય છે. તેમ સત્તસંગમાં રોજ બેસતા સામાન્ય માણસ પણ સૌને માટે માનનીય ને આદરશીય બની જાય છે. શિવજી સાથે પોઠિયો પણ પૂજાય છે. જોબનપગી સ.ગુ. શ્રી મુક્તાનાં સ્વામીના સત્તસંગથી અને વાલિયો લૂંટારો નારદ ઋષિના સત્તસંગથી વિશ્વવંદનીય બની ગયા.

ભગવાન શ્રીહરિ ગઢા પ્રથમ પ્રકરણના ઉઠોમા વચનામૃતમાં કહે છે: “આ સત્તસંગનો પ્રતાપ એવો છે જે, જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે, અને નિરૂત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે. અને સત્તસંગ વિના તો બીજા કોટિ સાધન કરે તોપણ તેને ઘાટની તથા રજોગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહીં.... જો નિષ્કપ્તપણે કરીને સત્તસંગ કરે ને પરમેશ્વરની વાતાને ધારે વિચારે તો મહિન ઘાટનો નાશ થાય છે, માટે સત્તસંગનો પ્રતાપ તો અતિશય મોટો છે; અને બીજા સાધન છે તે કોઈ સત્તસંગ તુલ્ય થાય નહિ, કંચે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી

તેની નિવૃત્તિ સત્તસંગમાં થાય છે, તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મહિન ઘાટ ટાણવા હોય તેને મન-કર્મ-વચને નિષ્કપ્તપણે સત્તસંગ કરવો તો સત્તસંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે.”

સ.ગુ. ભૂમાનંદ સ્વામી સત્તસંગનો મહિમા લખતાં કહે છે : ‘ધારા ધોર કળિ છે આજ, જે કર્ય સત્તસંગ તો રહે લાગ; જાવું ન પડે જમને દ્વાર, ચોરાશીનો આવે પાર; સરવે તારં સરશે કાજ.... છાછ ધૂટયાનો ઉપાય, એકજ છે જે સત્તસંગ થાય; સત્તસંગ થાય કિશોર વચ, ત્યારે ટળે કાળનો ભચ; જુવન પર્યાત હરિજશ ગાય... છાછા’

શ્રીજમહારાજ સારંગપુર પ્રકરણના દમા વચનામૃતમાં કહે છે : “અતિ સાચે ભાવે કરીને સત્તસંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હેયામાં રહે નહિ અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય.”

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢા મધ્ય પ્રકરણના પઠમા અને ગઢા અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં કહે છે : “એકાદશ સ્કર્ષના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહું છે જે, અષ્ટાંગયોગ, સાંઘ્ય, તપ, ત્યાગ, તીર્થ, પ્રત, યશ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્તસંગે કરીને વશ થઈ છું.”

સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી ‘ઉપદેશામૃત’ની ૮૦મી વાતમાં કહે છે : “સત્તસંગ વિના તો કામાદિક વૃદ્ધિ પામતા જાય છે. માટે સત્તસંગ કરવો એજ જીવનું સાર્થક છે.” અને ઉત્ત્રમી વાતમાં કહે છે : “ભીમનાથમાં રંકા (ભિભારીઓ) થુલું માગતા એવી સત્તસંગની ગરજ હોય તો સત્તસંગમાંથી પડાય નહિ.” સત્તસંગે કરીને બધું ખોટું થઈ જાય છે. પૂર્વજનમાં પુષ્યો ઉદ્ય થાય છે, ત્યારે જ સત્તસંગ પ્રત્યે પ્રીતિ જાગે છે. અને જીવને બળ પામવાનો હેતુ તો સત્તસંગ જ છે.

સત્તસંગનો પ્રભાવ એવો છે કે, આ જીવને કર્મ, માયા તથા કાળના બંધનમાંથી મુક્ત કરે છે. સત્તસંગથી પ્રકટ પરમાત્માને વિષે ભક્તિ ઉદ્ય થાય છે અને ભક્તિનું રક્ષણ પણ સત્તસંગથી જ થવા પામે છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સત્તસંગ પર ખૂબ ભાર મૂક્તાં કહું છે : “ગમે તેવો વિદ્વાન હોય તોપણ ભક્તિ અને સત્તસંગ વિના તે અધોગતિને પામે છે.”

ગોસ્વામી તુલસીદાસજી ‘શ્રીરામ ચરિત માનસ - રામાયણ’ ગ્રંથમાં સત્તસંગનો મહિમા કહેતા લખે છે : ‘શાશુદ્ધ સત્તસંગતિ પાઈ, પારસ પરસિ કુદ્ધાતુ સુહાઈ. મિદિબશ સુજન કુસંગતિ પરહીં, ફધીમહિસમ નિજગુણ અનુસરહીં. બદે ભાગ્ય પાઈય સત્તસંગા, લિનલી પ્રયાસ હોઈ ભવલંગા. પુષ્યાંજુ જિનુ મિલહિ ન સંતા, સત્તસંગતિ સંચુદ્ધિ કર અંતા. અસ લિયારી લોઈ કરે સત્તસંગા, હરિભક્તિ તેહિ સુલબ મિહંગા.’

“સત્તસંગ કરવાથી શઠ(ખરાબ) વ્યક્તિઓ પણ સુધરી



જાય છે. જેમ પારસમણિના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે, તેમ સત્સંગ કરવાથી ખરાબ માશસો એકાંતિક ભક્તો બની જાય છે. કદાચ કોઈ સત્સંગી ટેવયોગે કરી કુસંગીઓના સંગમાં બળી ગયા હોય તો પણ જેમ, સર્પનો મણિ પોતાના સ્વાભાવિક ગુણનો ત્યાગ કરતો નથી, તેમ સજજન પણ પોતાનો સત્સંગ છોડતો નથી.

જેનાં મોટાં ભાગ્ય હોય તેઓને જ સત્સંગની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્તિ થયા પછી, વિના પ્રયાસે જન્મ-મરણના ફેરા મટી જાય છે. તથા ધષાં પુણ્યો હોય ત્યારે જ સત્સંગના અંગ એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત સાચા સંતો મળે છે અને તેઓ સાથે સત્સંગ કરવાથી જન્મ-મરણ અને લખ-ચોરાશી ફેરાનો અંત આવી જાય છે. માટે આવો વિચાર કરી સત્સંગ કરવો તેથી ભક્તિ સુલભ થઈ જાય છે.”

સત્સંગનો પ્રતાપ અપરિમિત છે. સત્સંગ પ્રાચીન પાપોના સમૂહને, સંચિત કર્મના ફગલે ફગલાને, અજિન જેમ દારુને બાળી નાખે તેમ મૂળમંથી બાળી નાખે છે. સૂર્ય ઉદ્ય થાય કે રાત્રિ ક્યાં ગઈ તે દેખાય જ નહિ તેમ સત્સંગ થાય કે એ જીવના પાપ માત્ર નાશ પામી જાય છે.

માનવ શરીરમાં આખે આખું હૃદય બદલાવી દેવાની બાબતમાં ભલે વિજાને સફળતા મેળવી પણ હૃદયમાં રહેલી કડવાશને મીઠાશમાં ફેરવી નાખવામાં સફળતાનો ચશ તો સત્સંગને ફાળે જ જાય છે. પથ્થરને ભવ્યતા અર્પવી હોય તો એ શિલ્પીને સોંપાય, ગુંડાને નહિ. તેમ જીવનને ભવ્યતા અર્પવી હોય તો તે સત્સંગને સોંપાય, કુસંગને નહિ.

સત્સંગ કરીશું તેમાંથી કોઈક ગુણ આવશે પણ પથારી કરીને સૂર્ય રહેશું તો તેમાંથી કાંઈ નહિ વળે. બળટિયા હાંકે તો સારા રહે, ઘોરું ફેરવે તો સારું રહે, તેમ સત્સંગ કરે તો જીવ સારો રહે. બાર મહિનામાં એક મહિનો સંત સમાગમ કરશે તેનો સત્સંગ રહેશે ને જે સમાગમ નહિ કરે તેને ઘેર જરૂર ડાકલાં બેસવાનાં. સત્સંગ ગયો તો સર્વ ગયું. સત્સંગ કરે તો ધીરે ધીરે વાસના ક્ષીણ થાય પણ ધન-શ્વા-દ્વાલિમાન ને સ્વભાવ સત્સંગમાં રહેવા દે એવા નથી માટે કોઈ વાતે સત્સંગમંથી પાછું ન પડાય તે શીખવું. સત્સંગથી જીવમાં બળ આવે છે અને બળ આવે ત્યારે જીવમાં વળ આવે ને વળ આવે ત્યારે વિષયનો લીધો લેવાય નહિ. સત્સંગે કરીને મન ઇન્દ્રિયોને ઘસારો લાગે પણ મોળી વાતે ખરેખરા વત્તમાન ન પળે. શાસ્ત્ર ભષણું, સાંભળણું તે પણ પોતાના જીવમાં સમાસ થાય એવું ભષણું અને સાંભળવું. સમાસ થાય ત્યાં રહેવું, નહિતર ખોટ રહી જાય. શ્રીજીમહારાજના દીક્ષિત પરમચૈતન્યાનંદ સ્વાભાવીને સાકરનો શીરો ગળે રહેતો. પદાર્થ કોઈક લાવે તે પહેલું પોતા પાસે આવે પછી મહારાજ પાસે જાય એવા હતા. પોતે થોલિયો પણ મથાવેલ

રાખતા હતા પણ બાળમુરુંદાનંદ સ્વામીએ સેવામાં રહી બધું કઢાવી નાખ્યું. તે વઢવાણમાં દાણને લોટનો ગોળો ખવરાવ્યો ને પછી શ્રીજીમહારાજની મૂર્તિ સમક્ષ એક પગે ઊભા રહીને સુતિ કરતા જે ‘તમારા સાખું ઓળખાવતા નથી તે ઓળખાવજો ને હું બાર વરસ ગુરુ રહ્યો ને બાર વરસ સદગુરુ રહ્યો પણ સત્સંગી તો આજે બાળમુરુંદાસના સત્સંગે કરીને થયો.’

સારા ભગવદીય સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે. એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. અરધો અરધ કથાવાતાંનો યોગ રાખશે તેનું જ પાધરં રહેશે. સત્સંગ તો સાવરણી છે. જેમ ધરની સાવરણી કચરોપૂંજો વાળીને બહાર કાઢે છે એમ સત્સંગની સાવરણી ડેયામાં જામી ગયેલા કામ, કોધ, લોભ, મોહ, મદ, રાગ, દ્વેષ, ઈર્ષા આદિક દુર્ગુણોના કચરાના જાળાને બહાર કાઢે છે.

માનુષી જગતની અપ્રિય છતાં નરી સત્યતા એ છે કે, વ્યક્તિને કુસંગ તરફ સહજ અશાનવશ આકર્ષણ હોય છે. વ્યક્તિના ગુણો જાણવાને બદલે વ્યક્તિમાં રહેલા દોપોને વધુ માનવાની લોકોમાં વૃત્તિ હોય છે. તેથી વ્યક્તિ બીજા પર દોપોરોપણ કરતો જોવા મળે છે. જેટલું મનોરંજન અન્યાનો તમાશો જોવામાં થાય છે એટલો રસ કે આનંદ વ્યક્તિને કોઈનું સુખ જોઈને નથી મળતો. એવા વ્યક્તિમાં પોતાનું અને પારકું એવો આંદ ભાવ રહેતો હોય છે. વસ્તુનિષ્ઠ જગતમાં વ્યક્તિનિષ્ઠતા ઘટતી જોવા મળે છે પણ આ ઘટનાકમમાં કોઈ નવાઈની વાત નથી. કેમ કે, કળિયુગ પોતાની અસર દેખાડે એમાં કોઈ આશ્વર્ય નથી. ભાગવતના માણતયમાં નારદજીએ પણ આ પરિસ્થિતિનો સામનો કરતા કદ્યું છે કે, ‘સત્યં નાસ્તિ તપઃ શૌચं દયા દાનં ન વિદ્યાતે । ઉદરમભરીણો જીવા: વચ્ચકા: કૂટ ભાષિણ: ॥’ - જ્યારે જીવ કેવળ વ્યક્તિભાવે જીવે છે ત્યારે સરાચર જગતની ભાવનાને ભૂલી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણાની વાણી કહે છે કે, સચ્ચાચર જગત એક કુટુંબ છે ‘વસુદૈવ કુટુંબક્રમ’ પરંતુ કળિકાળમાં વ્યક્તિભાવે જીવતો વ્યક્તિ આ કુટુંબભાવનાને ભૂલી જ ગયો છે. કેવળ પોતાની જ ઈચ્છાપૂર્તિને સિદ્ધ કરનાર વ્યક્તિ અંધની જેમ પોતાની આસ-પાસનું દશ્ય જોઈ નથી. શક્તો અથવા તો એ જોવા નથી માંગનો. કેમ કે, એણે ઈહલોકને જ પોતાનું શાશ્વત સ્થાન માની લીધું છે.

વિચાર એ આવે કે, કઈ વાતને લઈને જીવ આવી અશાનદશામાં ભટકી રહ્યો છે ? જે ભારત ભૂમિ અને આ ભૂમિના સંતાનો વિષે કહેવાય છે કે, ‘વયં સર્વે અમૃતસ્ય પુત્રા: ॥’ - આપણે અમૃતના સંતાન ધીએ. ઋષિઓના સંતાન ધીએ તો એ આપણી અંદર રહેલું ઋષિતત્વ અને અમૃતત્વ ક્યાં ખોવાય ગયું ? જવાબ શોધતા બહુ દૂર દેખિ કરવાની જરૂર નથી. આ બાબતમાં સ્પષ્ટતા તો શ્રીમદ્ ભગવત् ગીતા કરે છે કે,

‘धूमेनाऽत्रियते वहनि: यथा दर्शो मलेन च ।’ - भत्तब जेम धूमाडामां अज्ञिं ढंकायेलो छे, जेम अरीसो रजथी ढंकायेलो छे, जेम माना उदरमां बाणक ओणथी ढंकायेलो छे - ऐम आपाणु अमृत तत्त्वमय शान अंधकारमय अशानथी ढंकायेलुँ छे. तो हवे प्रश्न ए थाय के ए अशान दूर केम थाय अने भीतर रहेलुँ शान प्रगट केम थाय ? जवाब छनुमान चालीसानो पेलो ढोलो आपे छे के, ‘श्रीगुरु चरन सोरज २४, निजमन मुकुर सुधारी...’ ए अशाननी २४ समर्थ महापुरुषोना चरणानो आश्रय करवाची दूर थाय छे. भत्तब के आ अशानने दूर करवा सत्संग अनिवार्य छे.

१४३ प्रथम प्रकरणां ५४मा वचनामृतमां श्रीछमहाराज आ सत्संगना भहिमाने उजागर करता डिमिडिम घोषणा करे छे के, ‘स एव साथु षुक्रतो मोक्षद्वारमपावृत्तम् ।’ - सत्संगे करीने ज मोक्षना द्वार उधाडा थशे. कुसंग छवने बंधनमां नाखे छे ज्यारे सत्संग मोक्षद्वारने खुल्ला करे छे.

प्रियज्ञो ! एक वात ध्यानमां राखजो के, गमे तेवा साधुना संगमां रहेवाथी मोक्ष मणी जशे अथवा पापो भस्मीभूत थई जशे ऐतुं समजवानी गलतभेमी न करशो. आत्मीतिक कल्याणाना भार्गे ए ज यडावी शके जे खुद मुक्त थवाने लायक होय....!!! अही एक नानकदुःदृष्टांत याद राखवा जेवुं छे.


ऐक्वायत एक राजाने अचानक वर्षो बाट सत्संग करवानुं मन थयुं ऐटले नक्की कर्युं के पहेला कोई विद्वान पासे जाणी तो लउं के सत्संग ऐटले शुं ? ऐमणे मंत्रीने आदेश कर्यो के आपाण राज्याना विद्वान पंडितने बोलावो. राजानी आशाथी मंत्रीये विद्वान ब्राह्मण पंडितने हाजर कर्यो. राजाए पंडितने कह्युं के, मारो मोक्ष थाय ए माटे तमारे मने रोज सत्संग कराववानो ने मने ए सत्संगनी वातोनो आनंद महेसुस थवो जोईये. विद्वान ब्राह्मण दक्षिणानी लालये उतावणे हा कहीने गयो. पढी तो प्रतिदिन ए राजाने सत्संगनी वातो करवा लाय्यो. एक भहिनो वीत्यो. राजाए पेला ब्राह्मणने कह्युं : “तमारी एक भहिनानी सत्संगनी वातोमां मने जराय आनंद न मण्यो तो मोक्ष तो केम करीने मणशो ?” हवे तमारी सत्संगनी वातोमां मने आनंद नहि मणी तो हुं तमने मृत्युदृढ आपीश. ब्राह्मण डर्यो अने कह्युं : “कालथी सारो सत्संग करावीश.” घरे जतां ब्राह्मण रस्तामां चिंतातुर थयो. हवे शुं कर्ण ? राजानो मोक्ष थाय अने ऐमने आनंद आवे ऐवो सत्संग केम करावुं ? भार्गमां संत मण्या. चिंतातुर ब्राह्मण पोतानी व्यथा जाणावी. संत दयाणु हता ऐटले कह्युं : “काले हुं तारी साथे राजा पासे आवीश.”

बीजा हिवसनी सवारे नक्की थया मुजब संत अने पेला

विद्वान ब्राह्मण राजाना राजदरभारमां मानवमेदनी वच्ये उपस्थित थया. संते समजाव्या प्रमाणे ब्राह्मणे कह्युं : “महाराज ! मारी साथे आ विद्वान संत आव्या छे ए बहु जानी छे. जे मारा पाण गुरु छे. ए तमने मोक्ष मने तेमज आनंद थाय ऐवो सत्संग जडूर संबणावशो.” राजाए कह्युं : “ठीक छे. कहो महात्माने के मने सत्संग करावे, जेथी मारो मोक्ष थाय.” संते कह्युं : “महाराज ! तमारो मोक्ष पाण थशे अने तमने सत्संगनु सुख पाण मणशो. परंतु हुं जेम कहुं ऐम तमारे करवुं पडशे. बोलो मंजुर छे ?” राजाए हा भणी. त्यारे संते कह्युं : “तमे बे क्षण माटे राजपट त्यागी दो अने मने राजा बनावी दो. जुओ पढी सत्संगनु सुख हुं तमने तमारी ज राजगाई ए बेसीने केवुं आपुं छुं ! तमारुं राजपट सलामत रहेशे ए मारी ज्वाबदारी पाण मोक्ष जोईतो होय तो में कह्युं ऐम करो.” राजाए मोक्षनी लालयमां तुरंत राजपट पेला संतने सोंपी दीधुं अने राजा ब्राह्मण पासे उभा रही गया.

पेला संत-महात्मा राजाना राज सिंहासन उपर बिराजमान थई गया. पढी सिपाईओने आदेश आप्यो के राजा अने पेला ब्राह्मणने दोरडे बांधीने पकडी लो, आ मारो आदेश छे. सिपाईओने तो राजगाई अथेथी जे कोई आक्षा मने तेने पाणवी रही. तुरंत बंनेने पकडीने बांधी देवामां आव्या. हवे पेला राजाए संतने कह्युं : “तमे दगो कर्यो छे. तमारे मने सत्संग करावी मोक्ष अपाववानो हतो. तेने बदले मने बांधी दीधो ? आ बंधनमांथी हमण्या ज मुक्त करो.” त्यारे संते कह्युं : “जे तमारे आ दोरडाना बंधनमांथी मुक्त थवुं होय तो पेला ब्राह्मणने कहो ए तमने छोडी आपशे.” राजाए कह्युं : “ए मने केवी रीते मुक्त करी शके. केम के ए पोते पाण दोरेदेवी बंधायेलो छे !” त्यारे पेला संत बोल्या : “बस, महाराज ! हुं पाण तमने ए ज समजाववा मांगुं छुं के जे पोते संसारना मोहमायाना बंधनोमां बंधायेलो होय ए तमने केम मुक्ति आपी शके ! मोक्ष माटे तो कोई समर्थ महापुरुषो आश्रय करवो पडे.”

आ दृष्टांतनो भावार्थ ए छे के, आपाणे ऐटलुं तो समज ज गया के मोक्ष एझ अपावी शके जे पोते मुक्त अवस्थामां ज्वतो होय. तेथी ज स.गु. श्री देवानंद स्वामी कहे छे : “अति मोटा पुरुषने आशरे रे, बणे पूर्व जनमना पाप तोय जाइया नहीं जगदीशने रे...” देवानंद स्वामीना शब्दो उपर ध्यान आपी ए के खाली मोटा पुरुष नहि पाण अति मोटापुरुष जेमना सानिध्यमां जतां ज शांतिनो अहेसास थाय. वणी, श्री राम चरित मानसना आधारे ऐवा मोटापुरुषनुं लक्षणाशुं ? तो ‘धृ विकार ज्ञत अनंद अकामा, अचल अकिञ्चन सुचि सुख धामा.’



# ભગવાન શ્રી સ્વામિનારાયણનું મહાન પ્રસાદીભૂત શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી

આજથી લગભગ બે દાયક પૂર્વનો એ સમય. વિકભના ૨૦૫૧ના વર્ષને આખાયે ભારતવર્ષ ભાવભીની વિદાય આપી અને ૨૦૫૨માં નવા સંવત્સરને હદ્યના ગોખથી આવકાર્યું.

અત્યારે આપણે બધા જે યુગમાં જીવી રહ્યા છીએ એના માટે કહેવું હોય તો કહી શકાય કે, ‘we are living in the age of energy.’ - આપણે બધા ઉર્જાયુગની અંદર જીવી રહ્યા છીએ. કારણ કે, આ યુગમાં કૃતિમ શક્તિનો વિકાસ અને કુદરતી શક્તિનું પરિશીલન અને વિનિમય માણસે જે હદે પોતાના જીવનમાં કર્યો છે એવો વિકાસ કે એવી શક્તિઓનો



તીર્થધામ સરદામને આંગાળો ઉજવાયો

# - વિંશાસ્ફી મહોત્સવ - ૨૦૧૫

સાધુ અમૃતસરપદાસજી તથા પા. સંદિપ ભગત ગુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસરપદાસજી

વિનિમય હજી સુધી અગાઉના યુગમાં કોઈ એ કર્યો નહોતો.

પૃથ્વી જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી સૂર્ય તપે છે અને ૭૩૮ પરાર્ધ કિલોવોટ્સ શક્તિ પ્રતિસેકાંડ પોતાના સ્વરૂપમાંથી બહાર ફેંકતો રહે છે. (૧ પરાર્ધ એટલે એકડા ઉપર ૧૮ મીંડા થાય.) સૂર્યમાંથી દરેક સેકન્ડે ૭૩૮ પર ૧૮ મીંડા ચડાવીએ એટલી કિલોવોટ્સ શક્તિ ફેંકાય છે. માણસે એ સૌરશક્તિનો આ યુગમાં ઉપયોગ કરવા માંડ્યો અને ઘરના કુકરમાં રસોઈથી માંડીને મોટા-મોટા યંત્રો આ સૌરશક્તિથી ચલાવતો થઈ ગયો છે.

માઈલોની ગણતરી રાખ્યા વિના અલમસ્ત જોગીની જેમ વહેતા વાયરાને માણસે પવનચક્કિના ચાકડે ધૂમાવ્યો અને એમાંથી વાતશક્તિ ઉત્પસ્ત કરી લીધી.

અમૃત જેવું મીહું પાણી દરિયામાં ભળીને અત્યાર સુધી ખારું ઝેર જેવું બની જતું હતું, પરંતુ આજે એ પાણી ઉપર મહાકાય બંધોના નિર્માણ કરી માણસે જળની શક્તિને પણ જળાશયમાં કેદ કરી લીધી છે.

નરી આંખે આપણે જોઈ પણ ન શકીએ એવા અણુમાંથી પણ પ્રચંડશક્તિ માણસે પોતે આજે પ્રામ કરી લીધી છે.

જમીનમાં ૩૦૦ ફૂટ કે ૫૦૦ ફૂટ ઊરે છૂપાયેલા ખનીજતેલને બહાર કાઢીને એમાંથી પણ જબરજસ્ત બળતણશક્તિ માણસે આજે પ્રામ કરી લીધી છે.

આવી તો કેટલીય કુદરતી શક્તિઓની ચાવીઓ માણસના હાથમાં આવી ગઈ છે અને આ શક્તિથી માણસે પોતાના જીવનમાં ઘણો બધો વિકાસ પણ કર્યો છે. જે પવન શક્તિની આપણે વાત કરી, એમાંથી માણસે કેટલી શક્તિ મેળવી ? તો એવું કહેવાય છે કે, ૪ મીટરના વ્યાસની પવનચક્કી હોય અને પવન ૧૦ માઈલ પ્રતિસેકન્ડની ઝડપે ફેંકતો હોય, તો એમાંથી માણસ વર્ષે ૩૫૦૦ કિલોવોટ્સ કલાક શક્તિ પ્રામ કરી શકે છે.

ચીનમાં યાંગત્સે નામની નદી વહે છે. આ નદી ઉપર ત્યાંની સરકાર એક વિરાટ સિંચાઈ યોજના તૈયાર કરી રહી છે. અને એવું કહેવાય છે કે, એ સિંચાઈ યોજના જ્યારે પૂર્ણ થશે ત્યારે ચીનમાં પ્રત્યેક વર્ષ એક અભજ અડસાઈ કરોડ કિલોવોટ્સ કલાક શક્તિ પેદા થશે. આ શક્તિ અત્યારે ખ્રાઝિલ અને ઉરુંવે દેશમાં તેની સીમા પર પર જે ઈટાયુયુ હાઈડ્રો ઇલેક્ટ્રિક સિસ્ટમ છે તેના કરતા પણ વધુ બની રહેશે. જોયું ! પાણીની અંદરથી માણસે કેટલી શક્તિ મેળવી ?

અણુશક્તિ ! એક અણુને તોડવાથી માણસે કેટલો વિકાસ કર્યો ? તો એવું કહેવાય છે કે, ઉત્ત લાખ કિલો કોલસો બાળવામાં આવે અને જે શક્તિ પેદા થાય એટલે શક્તિ આજે માણસ એક કિલો યુરેનિયમમાંથી પ્રામ કરી રહ્યો છે ! અને આ બળતણ શક્તિ દ્વારા જ અવકાશમાં રોકેટો મોકલીને આજે માણસે વિશ્વને એક નાનકડા ગામડા જેવું બનાવી દીધું છે.

આ શક્તિઓ દ્વારા ભૌતિક વિકાસની જબરજસ્ત હરણફળ માણસે ભરી છે. એને કોઈ ઇન્કારી શકે તેમ નથી,

કોઈ નકારી શકે તેમ નથી. પરંતુ આટલી બધી શક્તિઓનો આટલો બધો ઉપયોગ કર્યા પછી પણ આજે વિશ્વ કરી જગ્યાએ જઈને ઊભું છે એ બહુ વિચારવા જેવું છે....!!

જે માણસે અણુશક્તિ દ્વારા આટલી બધી ઊજાને પ્રામ કરી એ માણસે અણુશક્તિનો ઉપયોગ અણુશાસ્યો (એટમ બોમ્બ) બનાવવા પણ કર્યો અને તેથી આજે વિશ્વમાં એટલા બધા અણુશાસ્યો તૈયાર થઈ ચૂક્યા છે કે જેમના વડે ૧૮૦ અબજ માણસોને મારી શક્ય....!! આ આંકડાને નાનો સમજવાની ભૂલ ન કરતા. અત્યારે પૃથ્વીની વસ્તી માત્ર છ અબજની છે. એટલે કે સમગ્ર પૃથ્વીનો ત૦ વખત નાશ કરી શકે એટલી અણુશક્તિ આજે માણસ પાસે છે....!!!!

જે પવનની શક્તિથી માણસ પોતે ૩૫૦૦ કિલોવોટ્સ કલાક શક્તિ પ્રામ કરી શકે છે, એ જ વાતશક્તિનો ઉપયોગ માનવ આજે શેના માટે કરી રહ્યો છે ? માણસને મારી નાખવા માટે જ તો ! વિશ્વમાં મહાસત્તાઓએ રાસાયણિક બોમ્બ બનાવ્યા છે. આ બોમ્બની ખાસિયત શું છે તે ખબર છે ? આ બોમ્બ જ્યારે ફૂટે ત્યારે એમાંથી જેરી ગેસ નીકળતા હોય છે અને એ ગેસ પવનની સાથે ભળી જઈને દૂર-દૂર સુધી ફેલાઈ જાય છે. જ્યાં જ્યાં પવન જાય ત્યાં ત્યાં બધા જ માણસોને એ સૂવાડતો જાય. વાતશક્તિ દ્વારા પવનચક્કી તો ફરે જ છે, પણ આવતા વર્ષોમાં કાળચક પણ ફરતું થઈ જશે. પવનચક્કી દ્વારા વીજળી તો પેદા થઈ શકશે, પરંતુ વીજળી વાપરનાર માણસ પૃથ્વી પર હશે નહીં....!!!!

સમુદ્રમાં નદીના પાણીમાંથી માણસે કેટલી બધી શક્તિ બંધો બાંધીને માનવે ઉપયોગમાં લીધી. સિંચાઈ યોજનાઓ થઈ, પરંતુ અત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે ? દુનિયાની જે મોટી-મોટી સિંચાઈ યોજનાઓ છે, તેના પર મિસાઈલો પોતાની આંખ માંડીને બેઠી છે. જે ગતિએ પાણી જેતરોમાં પહોંચી લીલોછમ પાક તૈયાર કરે છે. એટલી જ ગતિએ આવનાર વર્ષોમાં મૃત્યુ પણ આપણી પાસે આવશે. કારણ કે, બધા જ બંધો જ્યારે યુદ્ધ ખેલાશે ત્યારે અચાનક તૂટી પડશે અને એ પાણીથી અસંખ્ય માણસો મૃત્યુ પામશે ! જેતરોમાં આ પાણીથી અનાજ પાકેલું હશે પણ એ જ પાણીની આત્તાયીનો ભોગ બનેલા માણસો નહિ હોય, તો અનાજ ખાશે કોણા ?

બળતણથી માણસે વ્યૂના જેવા સામાન્ય વાહનથી માંડીને

રોકેટો દોડાવ્યા, પરંતુ તે જ બળતણશક્તિનો ઉપયોગ માનવે રહ્યા છીએ. તેથી અત્યારે હવે આ યુગમાં એક એવી શક્તિની મિસાઈલ બનાવવા કર્યો છે. એક મિસાઈલ જ્યારે બને છે આવશ્યકતા ઊભી થઈ છે કે જે શક્તિ વિનાશ તરફ જનારા ત્યારે માણણ પાસેથી કેટલું બધું ખેંચીને એ વિશ્વના ચોકમાં બહાર પડે છે. આ વાત તા. ૮-૧૧-૮૧ના દિવસે ફાઓ પરિષદમાં શ્રીમતિ ઈન્ટિરા ગાંધીએ કરેલી. એમણે જણાવ્યું હતું કે, “એક મિસાઈલ વિશ્વમાં બહાર પડે છે, એ મિસાઈલ બનાવવાનું બંધ કરાય તો? મિસાઈલના ખર્ચમાંથી ૨૦ કરોડ વૃદ્ધાનું વાવેતર થઈ શકે. એક મિસાઈલના ખર્ચમાંથી ૫ કરોડ ગરીબ ભૂખ્યા બાળકોને જમાડી શકાય, એક મિસાઈલના ખર્ચમાંથી ૧૦ લાખ ટન ખાતર તૈયાર થઈ શકે. એક મિસાઈલના ખર્ચમાંથી ૬૫,૦૦૦ હજાર દવાખાના ચાલુ કરી શકાય, એક મિસાઈલના ખર્ચમાંથી ઉ લાખ ૪૦ હજાર પ્રાથમિક શાળાઓ બનાવી શકાય !! પરંતુ એ શક્તિ આજે વિનાશના માર્ગ વપરાઈ રહ્યો છે. માણસે એ શક્તિનો વિકાસ નકારાર તરફ જતા વિશ્વને ફરી પાછું શાંતિવનમાં પલટી તો ઘણો કર્યો, પરંતુ એ વિકાસ કરતા પણ વિનાશનું ડગાલું હંમેશા આગળ રહ્યું છે.”

આણુશક્તિ કહો, વાતશક્તિ કહો, જળશક્તિ કહો કે બળતણશક્તિ કહો; પરંતુ એ શક્તિથી જેટલો વિકાસ થયો એના કરતા આજે વિશ્વમાં વિનાશ વધારે થઈ રહ્યો છે. અને જો આમને આમ ચાલશે તો હજુ વધારે વિનાશ થવાનો છે. એટલે જ આ બધી પરિસ્થિતિ જોઈને એક ઉર્દૂ શાયરે લખ્યું છે કે :-

‘કેસી મશાલે લેકે, ચલે તીરંગીમે આપ, જો ભી થી રોશની, વહ ભી સલામત ન રહી...’

કેવી મશાલ ઉપાડીને આપણે અંધારામાં ચાલ્યા ? કે જે કાંઈ અજવાણું હતું એ અજવાણું પણ જતું રહ્યું...!!!! આ પ્રકારની પરિસ્થિતિ વિશ્વમાં નિર્માણ થયેલી છે. એટલે જ ટી.ઓસ ઈલિયટ નામના પશ્ચિમના મોટા તત્ત્વચિંતકે વાત કરી કે, ‘All our knowledge brings us nearer to our ignorance and all our ignorance brings us nearer to death; The cycle of leaven in 20<sup>th</sup> century brings us nearer to dust.’

આ વીસમી સદીમાં આપણું બધું જ જ્ઞાન આપણને ધૂળની નજીક લઈ ગયું છે. એટલે કે વિશ્વમાં વિનાશ કરવા તરફ જ આપણે દસ્તાઈ રહ્યા છીએ. તેથી અત્યારે હવે આ યુગમાં એક એવી શક્તિની આવશ્યકતા કરવા તરફ જ આપણે દસ્તાઈ

રહ્યા છીએ. તેથી અત્યારે હવે આ યુગમાં એક એવી શક્તિની આવશ્યકતા ઊભી થઈ છે કે જે શક્તિ વિનાશ તરફ જનારા વિશ્વને વિકાસના પંથે પાછું લઈ આવે. આજે એક એવી શક્તિની જરૂરીયાત ઊભી થઈ છે કે, જે ઉજ્જવલ થઈ જનારા વિશ્વમાં ફરીથી હરિયાળી ફેલાવી શકે. આજે એક એવી શક્તિની જરૂરીયાત ઊભી થઈ છે કે વિસર્જન તરફ દસ્તાના વિશ્વમાં સર્જકતાનું પરિમાણ ઉમેરી શકે.

આજે આપણે શક્તિયુગમાં જીવીએ છીએ, પરંતુ માણસ પોતે અશક્ત થઈ ગયા છે. આજે વિશ્વનો વિનાશ બચાવી શકે એવી કોઈ શક્તિ માણસ પાસે રહી નથી. કારણ કે, જે જે મિસાઈલના ખર્ચમાંથી ૬૫,૦૦૦ હજાર દવાખાના ચાલુ કરી શક્તિઓનું એણે નિર્માણ કર્યું કે વિકાસ કર્યો તે બધી જ શકાય, એક મિસાઈલના ખર્ચમાંથી ઉ લાખ ૪૦ હજાર પ્રાથમિક શાળાઓ બનાવી શકાય !! પરંતુ એ શક્તિ આજે વિનાશના માર્ગ વપરાઈ રહ્યો છે. માણસે એ શક્તિનો વિકાસ નકારાર તરફ જતા વિશ્વને ફરી પાછું શાંતિવનમાં પલટી તો ઘણો કર્યો, પરંતુ એ વિકાસ કરતા પણ વિનાશનું ડગાલું શકે, કુરુક્ષેત્રની સામે નંદનવનનું બધું કરી શકે.

#### મહર્ષિ અરવિંદ કહેતા - ‘Perfection of one man

can save the world.’ ‘આ વિશ્વમાં એક જ પૂર્ણ વ્યક્તિત્વવાળો માણસ હોય તો એ આખા વિશ્વને બચાવી શકે.’ તો આજે વિશ્વ જે વિનાશ બાજુ જઈ રહ્યું છે, વિશ્વ જે વિસર્જનની દિશામાં જઈ રહ્યું છે. એમાંથી એને સ્વર્ગ બનાવવા માટે આજે કોઈ મોરી શક્તિની જરૂરીયાત હોય તો એ છે - આધ્યાત્મિકતાની શક્તિ. આ શક્તિમાં એવો પાવર છે કે જે વિશ્વને પોતે બદલી શકે. આપણને પ્રશ્ન થાય કે એવું તો એની પાસે શું છે કે જેના દ્વારા એક જ વ્યક્તિ સમગ્ર વિશ્વની શિક્ષણ બદલી શકે ? આધ્યાત્મિક શક્તિમાં બળ કર્યું છે ? ‘It can change the within.’ માણસને અંદરથી બદલવો એ આધ્યાત્મિક શક્તિનું કાર્ય છે.

વિશ્વમાં આજે અત્યારાચી વલણા, અશાંતિમય વાતાવરણ અથવા તો તારાજુ વધેલી છે. તેનું કારણ શું છે ? તો વિશ્વનું માનસ વિશ્વમાનુષો ઘડતા હોય છે. કહે છે કે ‘જેવી વ્યક્તિ તેવી સૂચિ’ જેવો માણસ હોય એવું વિશ્વ બને છે. અને માણસને કોણ ઘડે છે ? માણસને એના સ્વભાવ ઘડે છે. વિશ્વમાનસ તેમાં વિશ્વમાનુષો દ્વારા ઘડાય છે. અને વિશ્વમાનુષો પોતાના સ્વભાવ દ્વારા ઘડાય છે. તેથી જે શક્તિ માણસના સ્વભાવનું પરિવર્તન કરી શકે તે જ વિશ્વનું પણ પુનઃ સર્જન કરી શકે.

આવો દિગ્ગજ વિચાર ભગવાન શ્રી સ્વામિનારાયણના અક્ષરધામ તુલ્ય જે ભૂમિમાં વિશાળ સરોવર, દરબારગઢ, પ્રપૌત્ર વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ধુ. ૧૦૦૮ શ્રી આચાર્ય દરબારગઢમાં લીંબવૃક્ષ, શ્રીજમહારાજે સ્વયં પૂજેલા શ્રી અજેન્ડ્રપ્રસાદજી મહારાજશ્રીના મસ્તિષ્કમાં ઉદ્ભબ્યો. જેના પરિણામ સ્વરૂપે ભગવાન શ્રીહરિના ચરણરજથી પ્રસાદીભૂત થયેલા તીર્થધામ સરધાને આંગણો પ.પૂ. ૧૦૮ શ્રી મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીનું પ્રથમ મેળાપ સ્થાન, માંકડનું કલ્યાણ સ્થાન વગેરે ભગવાન શ્રીહરિએ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગોઙ્ડપ્રસાદજી મહારાજશ્રીના પોતાના ચરણારવિંદથી પાવન કરેલા પવિત્ર તીર્થસ્થળોના અધ્યક્ષપદે પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના દર્શન કરી જીવનને ઘન્ય બનાવવા યોગ્ય છે.

કરુણાકર ભગવાન શ્રીહરિના અપરસ્વરૂપ પ.પૂ. ધ.ধુ. આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાને શિરોમાન્ય કરીને પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી થોડા સંતો સાથે વિકભ સંવંત ૨૦૫૨ના કારતક સુદ ૧૨, તા. ૪-૧૧-૧૯૮૮ના દિવસે સોરઠની એ રણિયામણી ધરા ઉપર નિવાસ કર્યો. જ્યાં સર્વાવતારી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સાત-સાત વખત પદ્ધાર્યા છે. જ્યાં મહાપ્રભુ શ્રીહરિએ અનેકવિધ લીલાચરિત્રો કરીને ભાવિમુખુઓને અવિસ્મરણીય ચિરસ્મૃતિ પ્રદાન કરી છે. જ્યાં રસિકવર શ્રીહરિએ અનેક ઉત્સવો કરીને ઉત્સવોની પરંપરા વહેતી કરી છે. જ્યાં ઉધ્ઘવાવતાર સદ્ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામી તથા સત્સંગની ‘મા’નું વહાલસોયું બિરુદ જેમને સ્વયં શ્રીજમહારાજે આય્યું છે એવા સ.ગુ. શ્રી મુક્તાનંદ સ્વામીનું પ્રથમ મિલન થયું છે.

પ્રિયતમ ભગવાન શ્રીહરિના પરમપ્રિય પાંચસો પરમહંસોના મહામંગલમય પદપંકજથી પુનિત થયેલ

દરબારગઢમાં લીંબવૃક્ષ, શ્રીજમહારાજે સ્વયં પૂજેલા શિવજી, સદ્ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીનું વર્ષીસ્થાન, સ.ગુ. શ્રી મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીનું પ્રથમ મેળાપ સ્થાન, માંકડનું કલ્યાણ સ્થાન વગેરે ભગવાન શ્રીહરિએ પોતાના ચરણારવિંદથી પાવન કરેલા પવિત્ર તીર્થસ્થળોના દર્શન કરી જીવનને ઘન્ય બનાવવા યોગ્ય છે.

સર્વેશ્વર ભગવાન શ્રીહરિએ મનુષ્યતનું ધારણ કરીને સમગ્ર વસુંધરાના પુણ્યવાન ભૂભાગ ભારતવર્ષને પરમપાવન કર્યો, અનેક ગામોને તીર્થધામ બનાવ્યા. ભૂમંડળના જે સ્થળ શ્રીજમહારાજના પાવન ચરણ દ્વારા પરમ તીર્થસ્થાન થયા તેમનું વર્ણન શબ્દથી કદાચ કોઈ કરે, તે તે તીર્થોમાં મહાપ્રભુએ કરેલા અનેકવિધ લીલાચરિત્રોનું વર્ણન પણ કદાચ કોઈ શબ્દદેહ આપીને વર્ણવાનો સંપૂર્ણ પ્રયાસ કરે તેમ છતાં એ માત્ર તે તે તીર્થો કે લીલાચરિત્રોનું વર્ણન જ કરી શકે, પરંતુ મહિમાનો પાર શેષ-શારદા કે સહસ્રશીર્ષ વિરાટ વગેરે કોઈ ક્યારેય પણ પામી શકે તેમ નથી. આવું જ એક મહાન તીર્થધામ છે સોરઠની ભૂમિ પર વસેલું સરધારધામ.

જ્યાં અક્ષરાધીશ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ સં. ૧૮૬૧ની સાલમાં ચાતુર્માસ દરમ્યાન રોકાયા હતા. તે વખતે ભગવાન શ્રીહરિના દિવ્ય વિગ્રહના પ્રત્યક્ષ સંસર્ગમાં આવેલા મહાપ્રાસાદિક વૃક્ષો, મકાનો, તળાવ અને બીજી અનેક વસ્તુઓ હજુ પણ મોજુદ છે. હજુ આજે પણ એ તમામ વૃક્ષ, સ્થળ કે જગતના દર્શને જશો ત્યારે પોતાના ઘન્યભાગ્યની

## ૨૫ મંડપગાળાથી આરંભાયેલી આ સત્સંગ છાવણી આજે



ગાથાને આપણાને સંભળાવવા તત્પર હોય એવી અદાથી દિવ્યતાનો મંગલ અનુભવ કરાવે છે. જન્મોથી સાધના કરી રહેલ અનેક સાધકો જે પરમતાત્પરા દર્શનની જાંખી માટે આકુળ-વ્યાકુળ હોય છે. એ પરમતાત્પર સાક્ષાત્ માણવા માટે એક નાનકડા ગામ સરધારના આ સ્થળોને અનાયાસે જ મળી ગયા. કેટલા ભાગ્ય હશે એમના....!!!

એ એક-એક સ્થળોનો મહિમા લખવા બેસીએ અને ફક્ત વર્ષન જ લખીએ કે પછી ઈતિહાસ લખીએ, તો પણ મોટો ગ્રંથ અને મહિમા તો લખી જ ન શકાય. તેમ છતાં શ્રીમદ્ સત્સંગિજીવન કે શ્રીહરિલીલામૃત જેવા શાસ્ત્રોએ આ મહાન તીર્થરાજનો મહિમા આંકંદ ગાયો છે.

આવા પરમ પવિત્ર તીર્થસ્થાનને વિષે પ.પૂ. ધ.ধ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્નપ્રસાદજી મહારાજશ્રીના આશાથી પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીએ પોતાના સંતમંડળ સાથે સરધારમાં નિવાસ કર્યો.

### ■■■ મોક્ષનું સદાગ્રત : સત્સંગ છાવણી

આમ તો સત્સંગ છાવણીની શરૂઆત ભગવાન શ્રી સ્વામિનારાયણે જ કરી હતી. તેરા ગામમાં બધા પરમહંસોને એકનિત કરીને પોતાના સર્વોપરીપણાની જોરદાર વાતો કરીને પરમહંસોને નિષાના કેફથી ભરી દીધા હતા.

ભગવાન શ્રીહરિના સ્વધામગમના પછી આદિઆચાર્યપ્રવર શ્રીરધૂવીરજી મહારાજે વડતાલમાં સં ૧૮૧૨ ચાતુર્માસમાં સાડા-ચાર મહિનાની સત્સંગ છાવણી કરાવી હતી. જેમાં સ.ગુ. શ્રી શુક્રાંદ સ્વામી આદિક સંતો

અને શાસ્ત્રી ભોગાનાથ ભણું ‘શ્રીમદ્ સત્સંગિજીવન’ ગ્રંથની કથા કરે અને કથાનું સત્ર પૂર્ણ થાય ત્યારે સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી શ્રીજમહારાજના સર્વોપરીપણાની, ધર્મ-ભક્તિ-શાન-વૈરાગ્યની દૃઢતા તેમજ સંસારના અસારપણાની વાતો કરીને અનેક મુખુકુઓના જીવનમાં છતે દેહે જ ભગવાનને પામી જવાની ઉત્કંઠા જગાવી હતી. સ્વામીએ આ છાવણીમાં વિષયખંડનની એવી અસરકારક વાતો કરી હતી કે, ઘરડા-ઘરડા પણ ચાંદ્રાયણ ને ધારણા-પારણા આદિક પ્રતો કરવા માંડ્યા હતા.

સત્સંગ છાવણીની એ જ પરંપરાને પ.પૂ. ધ.ধ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્નપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આશાથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિચાચાર્ય શ્રી નૃગેન્નપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષપદે પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના માર્ગદર્શન પ્રમાણે તીર્થધામ સરધારમાં પ્રથમ સત્સંગ છાવણી તા. ૧૩-૧૧-૧૯૮૬ થી ૨૦-૧૧-૧૯૮૬ ને સં. ૨૦૫૨ કારતક સુદ - ૨ (ભાઈબીજ)થી ૧૦ સુધી યોજાણી.

ઈ.સ. ૧૯૮૬થી તીર્થધામ સરધારમાં આરંભાયેલી ‘શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી’ની અણામોલ પરંપરા આજે ૨૦ વર્ષે પણ અવિરત ચાલુ છે. અલબત્ત, તેમાં ઉત્તરોત્તર અનેક આદ્યાત્મિક પ્રગતિઓ થઈ છે. આ વાતને થોડા ભાવવાડી શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે, ‘ઈ.સ. ૧૯૮૬માં સરધારમાં જન્મેલી સત્સંગ છાવણીની આજે ૨૦ વર્ષે ભરજુવાની તરવરે છે.’

## ૪૦૦X૨૫૦ ડોમનો સભામંડળ નાનો પડવા લાગ્યો છે....



સત્સંગ છે ત્યાં ભક્તિની સુવાસ છે અને ભક્તિ છે ત્યાં ભગવાનના સ્વરૂપ માધુર્યનું સુખ છે. છેલ્લા બે દાયકાથી ચાલતી ‘શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી - સરધાર’ આ વર્ષ એટલે કે ૨૦૧૫માં પોતાના ૨૦ વર્ષ પૂર્ણ કરે છે. જે સત્સંગ છાવણીમાં સૌ હરિભક્તોને આત્મસ્વરૂપ તેમજ પરબ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન પ્રતિપાદન કરવામાં આવે છે. જીવ જ્યાં સુધી પોતાના સ્વરૂપને ન જાણી શકે ત્યાં સુધી પરબ્રહ્મની પણ ઓળખાણ થતી નથી. આ બંને તત્ત્વોનો પરિચય સત્સંગ છાવણીના માધ્યમથી થાય છે.

સરધારધામમાં યોજાતી આ ‘સત્સંગ છાવણી’ એ સંપ્રદાયનો જૂનો તેમજ ઉપાસના-ભક્તિ-જ્ઞાનવર્ધક પ્રયાસ છે. જેમાં ઉપસ્થિતિ ધરાવનાર તમામ હરિભક્ત ભાઈઓ-ભાઈનો, યુવકો-યુવતીઓ તેમજ બાળકો માટે ભજન-ભોજન-નિવાસની સાથે સાથે અધ્યાત્મવિદ્યાની આગામી સૂક્ષ્મ સંતોના જ્ઞાન તેમજ વિદ્ગતા સભર કથાપવચનો દ્વારા આપવામાં આવે છે. ‘સા વિદ્યા યા વિમુક્તયે’ના વિવેક પ્રબોધનથી આ સત્સંગ છાવણીનો પ્રારંભ થાય છે અને ‘નિજાત્માન બ્રહ્મરૂપમ्’ સુધીની અદ્યાત્મ ગ્યાત્રા આ સત્સંગ છાવણીનો સંસ્કાર પાયો છે.

જીવની અવસ્થા મુક્ત છે, પણ સંસાર સાથે વાસનાનો સંબંધ જોડી જીવ પોતાની અવસ્થાને બદ્ધ બનાવે છે. જેમાં માયા અજ્ઞાન આવરણની જેમ ભાગ ભજવતી હોય છે. સત્સંગ છાવણીનું પ્રયોજન જીવાત્માને માયાના બંધનોમાંથી મુક્ત કરી, જીવમાં રહેલી સંસારની વાસનાને નિર્મૂળ કરી, જીવને અજ્ઞાન અવસ્થામાંથી બહાર કાઢી, એમના વિશુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવી, એમને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણના સ્વરૂપનું સુખ માણણો કરી, એમના માનવ જન્મને કિદ્દ્ર તેમજ સાર્થક કરવાનું છે.

‘સંસારમાં સરસો રહે પણ મન રહે મારી પાસ’ એમ સંસાર બાધકરૂપ નથી પણ એમાં રહેલી અસસ્થવાસનારૂપ આસક્તિ બંધનકર્તા છે. એ આસક્તિને ટાળવાનું કાર્ય સત્સંગ છાવણીના માધ્યમથી થાય છે. સત્સંગ એટલે જેના દ્વારા ભગવાન શ્રીહરિનું સાયુજ્ય મળે અને છાવણી એટલે એ છાયામાં ભક્ત પરબ્રહ્મ સ્વરૂપનું નિત્ય સુખ માણણો રહે. લોકિક સુખ માટે તો બહુ ભટક્યા હવે અલોકિક ભગવાન શ્રીહરિના સાયુજ્ય-સામીયની મોજ માણીયે, પોતાના માટે તો ખૂબ જીવા હવે જોણે જીવનરૂપ અમૃત આપ્યું એવા પરમાત્માની યાદમાં શેખુંઘણવન વ્યતીત કરીએ.

એનો ઉત્સાહ... ભક્તિભાવ... ભગવાન શ્રીહરિને બેટવાની તાલાવેલી... અક્ષરધામતુલ્ય દિવ્ય સુખની મહા ચાલતી ‘શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી - સરધાર’ આ વર્ષ એટલે કે ૨૦૧૫માં પોતાના ૨૦ વર્ષ પૂર્ણ કરે છે. જે સત્સંગ છાવણીમાં સૌ હરિભક્તોને આત્મસ્વરૂપ તેમજ હરિભક્તો પ્રત્યે - સંતો પ્રત્યે... સંતોનો હરિભક્તો પ્રત્યે અને સંતો-હરિભક્તોનો ધર્મકુળ પ્રત્યે... ધર્મકુળનો સંતો-હરિભક્તો પ્રત્યે અવાણીની પ્રેમભાવ તો માણ્યો હોય એ જ જાણે...!!!

તેમાં પણ પ્રથમ સત્સંગ છાવણીથી નવમી સત્સંગ છાવણી સુધી તો દર વર્ષે ભાઈબીજ થી આરંભીને કારતક સુદ - ૧૦ સુધીનો કાર્યક્રમ રહેતો. પરંતુ દશમી છાવણીથી સમયમાં પરિવર્તન આવ્યું. તા. ત થી ૧૧-૧-૨૦૦૫ ને સં. ૨૦૬૧ આસો વદ ૧ ત (ધનતેરસ) થી કારતક સુદ - ૮ સુધીનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું. સત્સંગ છાવણીનો સમય ફેરફાર કરવાનું કારણ એ હતું કે, દીપાવલી-નૂતન વર્ષ ભક્તોનું પંચવર્તમાન યુક્ત સંતો-હરિભક્તોનોના સાસ્ત્રિયમાં ઉજવાય. નૂતન વર્ષનો મંગલ પ્રારંભ બ્રહ્મનિષ સંતોના મુખમાંથી સુદૂરતા અને આપણા કર્ણપટ પર મુલાયમ સ્પર્શ કરી જતા ભગવાન શ્રી સ્વામિનારાયણના મંગલ નામ શ્રવણથી થાય અને આપણા મનના ખૂણો-ખાંચકે લાપાઈને બેઠેલા અનેક કુવિચારોને નષ્ટ કરતા જાય. મન નિર્મણ થઈ જાય.

શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી - સરધાર પોતાના સત્સંગ માધુર્યના ૨૦ વર્ષ પૂર્ણ કરે છે. જે સમગ્ર સંપ્રદાયને માટે ગોરવપૂર્ણ વાત છે. જેની શુભકામના અમો આપ સૌ કોઈ હરિભક્તોને પાઠવીએ છીએ અને આશા કરીએ છીએ કે, આમ જ લાખોની સંખ્યામાં સત્સંગ છાવણીનો આપ સૌ લાભ લેતા રહો. જેનાથી સૌનું જીવન મંગળ બને અને આપણે સૌ આ સત્સંગની તરફાયામાં સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વરૂપમાં ગુલતાન બની, આત્મરૂપને ઓળખી પરમાત્મ સુખમાં ગરકાવ થઈએ.

બસ. આવી જ દિવ્યતા ભરી વીસ-વીસ સત્સંગ છાવણી ભરીને કેટલાક મુમુક્ષુ જીવાત્માઓ ભગવાનદ્વારા થઈ ગયા. કેટલાય સંસાર છોડીને સાખુ થઈ ગયા, તો કેટલાય સંસારમાં હોવા છતાં પરમભક્ત થઈ ગયા....!! હજુ પણ ‘ચાવત્યંદ્રદ્વિવાકરો’ આવી સત્સંગ છાવણીઓ દ્વારા અનંત મુમુક્ષુજીવાત્માઓ અલભ્ય લાભ લેતા રહે એવી શુભભાવના સહ... જય શ્રી સ્વામિનારાયણ.

## શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી - સરધાર તવારીખ

ક્રમ	તારીખ
પ્રથમ સત્સંગ છાવણી	તા. ૧૩ થી ૨૦ નવેમ્બર ૧૯૮૬ સં. ૨૦૫૨ કારતક સુદ - ૨ (ભાઈબીજ) થી ૧૦
દ્વિતીય સત્સંગ છાવણી	તા. ૨ થી ૧૦ નવેમ્બર ૧૯૮૭ સં. ૨૦૫૩ કારતક સુદ - ૨ (ભાઈબીજ) થી ૧૦
તૃતીય સત્સંગ છાવણી	તા. ૨૨ થી ૩૦ ઓક્ટોબર ૧૯૮૮, સં. ૨૦૫૪ કારતક સુદ - ૨ (ભાઈબીજ) થી ૧૦
ચતુર્થ સત્સંગ છાવણી	તા. ૧૦ થી ૧૮ નવેમ્બર - ૧૯૮૯, સં. ૨૦૫૫ કારતક સુદ - ૨ (ભાઈબીજ) થી ૧૦
પાંચમી સત્સંગ છાવણી	તા. ૨૮ ઓક્ટો. થી ૬ નવેમ્બર ૨૦૦૦, સં. ૨૦૫૬ કારતક સુદ-૨ (ભાઈબીજ) થી ૧૦
છ્યાં સત્સંગ છાવણી	તા. ૧૭ થી ૨૫ નવેમ્બર ૨૦૦૧, સં. ૨૦૫૭ કારતક સુદ - ૨ (ભાઈબીજ) થી ૧૦
સાતમી સત્સંગ છાવણી	તા. ૦૬ થી ૧૪ નવેમ્બર ૨૦૦૨, સં. ૨૦૫૮ કારતક સુદ - ૨ (ભાઈબીજ) થી ૧૦
આઠમી સત્સંગ છાવણી	તા. ૨૭ ઓક્ટો. થી ૩ નવે. - ૨૦૦૩, સં. ૨૦૫૯ કારતક સુદ-૨ (ભાઈબીજ) થી ૧૦
નવમી સત્સંગ છાવણી	તા. ૧૪ થી ૨૪ નવેમ્બર - ૨૦૦૪, સં. ૨૦૬૦ કારતક સુદ - ૨ (ભાઈબીજ) થી ૧૦
દસમી સત્સંગ છાવણી	તા. ૩ થી ૧૧ નવેમ્બર - ૨૦૦૫, સં. ૨૦૬૧ આસો વદ - ૧૩ થી કારતક સુદ - ૮
અગિયારમી સત્સંગ છાવણી	તા. ૭ થી ૧૫ જાન્યુઆરી - ૨૦૦૭, સં. ૨૦૬૨ પોષ વદ - ૪ થી ૧૧
બારમી સત્સંગ છાવણી	તા. ૭ થી ૧૮ નવેમ્બર - ૨૦૦૭, સં. ૨૦૬૩ આસો વદ - ૧૩ થી કારતક સુદ - ૮
તેરમી સત્સંગ છાવણી	તા. ૨૬ ઓક્ટો. થી ૬ નવેમ્બર-૨૦૦૮, સં. ૨૦૬૪ આસો વદ-૧૩ થી કારતક સુદ - ૮
ચોદમી સત્સંગ છાવણી	તા. ૧૬ થી ૨૬ ઓક્ટો. -૨૦૦૯, સં. ૨૦૬૫-૬૬ આસો વદ-૧૩ થી કારતક સુદ - ૮
પંદરમી સત્સંગ છાવણી	તા. ૩ થી ૧૦ નવેમ્બર - ૨૦૧૦, સં. ૨૦૬૬ આસો વદ - ૧૩ થી કારતક સુદ - ૫
સોળમી સત્સંગ છાવણી	તા. ૨૪ ઓક્ટોમ્બર થી ૩ નવેમ્બર-૨૦૧૧, સં. ૨૦૬૭ આસો વદ-૧૩ થી કારતક સુદ-૮
સતરમી સત્સંગ છાવણી	તા. ૧૧ થી ૨૦ નવેમ્બર - ૨૦૧૨, સં. ૨૦૬૮ આસો વદ - ૧૩ થી કારતક સુદ - ૮
અણારમી સત્સંગ છાવણી	તા. ૧ થી ૮ નવેમ્બર - ૨૦૧૩, સં. ૨૦૬૯ આસો વદ - ૧૩ થી કારતક સુદ - ૮
ઓગાણીસમી સત્સંગ છાવણી	તા. ૨૦ થી ૨૬ ઓક્ટોમ્બર - ૨૦૧૪, સં. ૨૦૭૦ આસો વદ - ૧૨ થી કારતક સુદ - ૩
વીસમી સત્સંગ છાવણી	તા. ૮ થી ૧૭ નવેમ્બર - ૨૦૧૫, સં. ૨૦૭૧ આસો વદ - ૧૩ થી કારતક સુદ - ૬



# સત્સંગ સમાચાર પત્રિકા

સ્વામી ધનશ્યામદાસજી તથા શા. સ્વામી સર્વમંગલદાસજી તથા સાધુ ધર્મવલ્લભદાસજી



વડોદરાને આંગણે ન્યાલકરણ ચુપ દ્વારા નિર્મિત નૂતન સાઈટનું ખાતમુહૂર્ત કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.




શ્રી રધુવીર વારી - વડતાલ ખાતે દરેરાના પવિત્ર દિવસે શ્રીજમહારાજના પ્રાસાદીક શસ્ત્રોનું પૂજન-અર્યન કરતા પ.પૂ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય પ.પૂ. લાલજી મહારાજશ્રી સહિત સમગ્ર ધર્મકુળ પરીવાર તેમજ દર્શન લાભ લેતા સંતો-ભક્તો.




તुलसी विवाह  
रामपर (राजुला)

ગढા પ્રદેશના રામપર (રાજુલા) ગામને આંગણે યોજાયેલ તુલસી વિવાહ પ્રસંગે પધારતા પ.પુ. લાલજી મહારાજશ્રી.



સત્સંગ સભા  
છાપરી

ગડા પ્રદેશના છાપરી (તા. મહુવા) ગામને આંગણે યોજાયેલ સત્સંગ સભામાં આશીર્વાદ પાઈવતા પ.પુ. લાલજી મહારાજશ્રી.



કથા પારાયણ  
ખેરાળી

ગડા પ્રદેશના ખેરાળી ગામને આંગણે યોજાયેલ કથાપારાયણ પ્રસંગે પધારતા પ.પુ. લાલજી મહારાજશ્રી.



કથાપારાયણ  
મોટા કણકોટ

જૂનાગઢ પ્રદેશના મોટા કણકોટ ગામને આંગણે યોજાયેલ કથાપારાયણ પ્રસંગે પધારતા પ.પુ. લાલજી મહારાજશ્રી.

સત્સંગ ઉત્કર્ષ મહોત્સવ  
દાતરડી



ગઢા પ્રદેશના દાતરડી (તા. રાજુલા)ને અંગણે પ.પુ. લાલજી મહારાજશ્રીના દિવ્ય સાસિધ્યમાં યોજાયેલ 'શ્રી સ્વામિનારાયણ સત્સંગ ઉત્કર્ષ મહોત્સવ.'

મહુવા




મહુવા મંદિરમાં બિરાજમાન ઠાકોરજના દર્શને પધારતા તેમજ ભક્તજનોને આશીર્વાદ પાઠવતા પ.પુ. લાલજી મહારાજશ્રી.



સાવરકુંડલા

ગઢા પ્રદેશના સાવરકુંડલા શહેરમાં નૂતન ફેક્ટરીનું ઉદ્ઘાટન કરતા તેમજ ભક્તજનોને આશીર્વાદ પાઠવતા પ.પુ. લાલજી મહારાજશ્રી.



મલાડ (મુંબઈ) ખાતે શ્રી સ્વામિનારાયણ હરિમંહિરમાં વાતાનુકૂલિત હોલનું ઉદ્ઘાટન કરતા પ.પુ. લાલજી મહારાજશ્રી.



સાકીનાકા (કુલા) ખાતે પ.પુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી યોજાયેલ સત્સંગ સભામાં કથાવાર્તાનો લાભ આપતાં પ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી



શ્રી રધુવીર વારી - વડતાલ ખાતે પ.પુ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય  
પ.પુ. લાલજી મહારાજશ્રી સહિત સમગ્ર ધર્મકુળ પરીવારના દિવ્ય સાસ્ત્રધ્યમાં યોજાયેલ 'શરદોત્સવ'

## શરદોત્સવ સરધાર



તીર્થધામ સરધારને આંગણે પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી યોજાયેલ 'શરદોત્સવ'

## શરદોત્સવ ડોંબીવલી (મુંબઈ)



ડોંબીવલીને આંગણે પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી યોજાયેલ 'શરદોત્સવ' પ્રસંગે કથાવાત્તર્ણનો લાભ આપતાં પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

## શરદોત્સવ દહિસર (મુંબઈ)



દહિસરને આંગણે પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી યોજાયેલ 'શરદોત્સવ' પ્રસંગે કથાવાત્તર્ણનો લાભ આપતાં પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

## માસિક સભા જૂનાગઢ



તીર્થધામ જૂનાગઢને આંગણે મંદિર પટંગાણમાં યોજાયેલ માસિક સત્સંગ સભામાં કથાવાત્તર્ણનો લાભ આપતાં પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી



ગઢા પ્રદેશના નાના જીંજાવદર ગામને ભુંગળીયા પરિવાર આયોજિત કથાપારાયણ પ્રસંગે પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.



ગઢા પ્રદેશના હિપાવડલી (તા. સાવરકુંડલા) ગામને યોજાયેલ કથાપારાયણ પ્રસંગે પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.



ગઢા પ્રદેશના બીલા (તા. મહુવા) ગામને સત્સંગ સમાજ દ્વારા આયોજિત કથાપારાયણ પ્રસંગે પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.



ગઢા પ્રદેશના પીપળવા (તા. લાઠી) ગામને યોજાયેલ કથાપારાયણ પ્રસંગે પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.

**સત્સંગ સભા  
રામપર (લાઠી)**




ગઢા પ્રદેશના રામપર (લાઠી) ગામને આંગણે મંદિરમાં બિરાજમાન દાકોરજની આરતી ઉતારતા તેમજ સત્સંગ સભામાં આશીર્વાદ પાઠવતા પ.પુ. લાલજી મહારાજશ્રી.

**સત્સંગ સભા  
નવાગામ (ટસા)**



ગઢા પ્રદેશના નવાગામ (તા. ટસા) ગામને યોજાયેલ સત્સંગ સભામાં આશીર્વાદ પાઠવતા પ.પુ. લાલજી મહારાજશ્રી.

**શ્રીહરિ યાગ  
સાવરકુંડલા**



ગઢા પ્રદેશના સાવરકુંડલાને મહિલા મંદિર દ્વારા આપ્યોજ્ઞ શ્રીહરિ યાગ યજમાં બીજું હોમતા પ.પુ. લાલજી મહારાજશ્રી.

**મહુવા**



મહુવાને આંગણે નૂતન શિખરબધ્ય મંદિરના નિર્માણકાર્યનું નિરક્ષણ કરતા પ.પુ. લાલજી મહારાજશ્રી.

પ.પુ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી આજેન્ડ્રપ્રસાદશ્રી મહારાજશ્રીના રૂડ આશીર્વાદ સહ આજાશી શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર દ્વારા તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ-વિદેશમાં ચુપ્પિષ્ઠ વક્તા પૂ. સ.ગુ. સ્વામી નિત્યવિષ્ટપ્રદાસજ્ઞા માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલ

## જૂતન હરિમંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા તથા કથા મહોત્સવોની તિથિ-તારીખ

ક્રમ	કથા તારીખ	કથા તિથિ	પ્રતિષ્ઠા તિથિ	સ્થળ
૧.	૩-૧૨-૨૦૧૫ થી ૪-૧૨-૨૦૧૫	કારતક વદ - ૮ થી કારતક વદ - ૧૪	જૂતન હરિમંદિર ખાતમુહૂર્ત	મુ. ઐરા, જી. દરભંગા, બિલાર (મિથિલાક્ષ્મે) સંપર્ક :- મો. ૦૭૨૮૬૦૧૮૨૨૪
૨.	૧૮-૧૨-૨૦૧૫ થી ૨૫-૧૨-૨૦૧૫	માગશર સુદ - ૮ થી માગશર સુદ - ૧૫	મંદિર દશાખ્ટી મહોત્સવ	મુ. નાના મુંજુયાસર, તા. બગસરા, જી. અમરેલી. સંપર્ક :- મો. ૮૦૮૮૫૨૮૦૨૦
૩.	૩-૧-૨૦૧૬ થી ૮-૧-૨૦૧૬	માગશર વદ - ૮ થી માગશર વદ - ૩૦	શ્રી સ્વામિનારાયણ મહોત્સવ	મુ. જેલ (વડતાલ), તા. જી. આંણંદ સંપર્ક :- મો. ૮૮૨૫૧૩૪૧૦૮
૪.	૧૧-૧-૨૦૧૬ થી ૧૮-૧-૨૦૧૬	પોષ સુદ - ૨ થી પોષ સુદ - ૧૦	જૂતન મંદિર શિવાન્યાસ મહોત્સવ	શ્રી સ્વા. મંદિર, માર્કેટીંગ યાર્દની સામે, ચિત્રા ભાવનગર સંપર્ક :- મો. ૮૦૮૮૮૮૮૮૮૩૦/૪૫
૫.	૨૬-૧-૨૦૧૬ થી ૩૦-૧-૨૦૧૬	પોષ વદ - ૨ થી પોષ વદ - ૬	પ્રતિષ્ઠા મહોત્સવ પોષ વદ - ૬	મુ. શ્રી સ્વા. મંદિર - ઘારી ગુંડાળી, તા. ભેંસાણ, જી. જૂનાગઢ સંપર્ક :- મો. ૮૪૨૮૮૩૬૭૦૮૦
૬.	૩૧-૧-૨૦૧૬ થી ૪-૨-૨૦૧૬	પોષ વદ - ૭ થી પોષ વદ - ૧૧	પ્રતિષ્ઠા મહોત્સવ પોષ વદ - ૮	મુ. શ્રી સ્વા. મંદિર - મેઘલપુર, તા. સોજાના, જી. આંણંદ સંપર્ક :- મો. ૮૮૨૫૧૩૪૧૦૮, ૮૭૧૪૨૭૫૮૭૭
૭.	૧૦-૨-૨૦૧૬ થી ૧૬-૨-૨૦૧૬	મહા સુદ - ૨ થી મહા સુદ - ૮	પ્રતિષ્ઠા મહોત્સવ મહા સુદ - ૨	મુ. શ્રી સ્વા. મંદિર - રાણસીકી, તા. ગોડલ, જી. રાજકોટ સંપર્ક :- મો. ૮૮૨૫૫૬૬૦૧૫, ૮૮૭૯૦૧૬૮૮૨
૮.	૨૫-૨-૨૦૧૬ થી ૨-૩-૨૦૧૬	મહા વદ - ૩ થી મહા વદ - ૮	મંદિર પંચાખ્ટી મહોત્સવ	મુ. શ્રી સ્વા. મંદિર - કાલોલ, જી. પંચમહાલ સંપર્ક :- મો. ૮૮૨૫૧૩૪૧૦૮, ૮૩૭૬૧૭૭૫૮૮
૯.	૧-૩-૨૦૧૬ થી ૫-૩-૨૦૧૬	મહા વદ - ૭ થી મહા વદ - ૧૧	પ્રતિષ્ઠા મહોત્સવ મહા વદ - ૧૧	મુ. શ્રી સ્વા. મંદિર - અભલોડ, તા. જી. દાહોદ સંપર્ક :- મો. ૮૮૨૫૧૩૪૧૦૮, ૮૭૩૭૨૪૮૭૭૨
૧૦.	૫-૩-૨૦૧૬ થી ૮-૩-૨૦૧૬	મહા વદ - ૧૧ થી મહા વદ - ૩૦	પ્રતિષ્ઠા મહોત્સવ મહા વદ - ૧૧	મુ. શ્રી સ્વા. મંદિર - ખરોડ, તા. લીમખેડા, જી. દાહોદ સંપર્ક :- મો. ૮૮૨૫૧૩૪૧૦૮, ૮૮૭૮૨૫૫૭૩૩
૧૧.	૧૧-૩-૨૦૧૬ થી ૧૫-૩-૨૦૧૬	ફાગણ સુદ - ૩ થી ફાગણ સુદ - ૭	પ્રતિષ્ઠા મહોત્સવ ફાગણ સુદ - ૩	મુ. શ્રી સ્વા. મંદિર - સર, તા. જી. રાજકોટ સંપર્ક :- મો. ૮૦૮૮૮૮૮૮૩૭
૧૨.	૧૧-૩-૨૦૧૬ થી ૧૫-૩-૨૦૧૬	ફાગણ સુદ - ૩ થી ફાગણ સુદ - ૭	પ્રતિષ્ઠા મહોત્સવ ફાગણ સુદ - ૩	મુ. શ્રી સ્વા. મંદિર - ઉમરાળી, તા. જસદાણ, જી. રાજકોટ સંપર્ક :- મો. ૮૦૮૮૮૮૮૮૩૭
૧૩.	૨૩-૪-૨૦૧૬ થી ૨૭-૪-૨૦૧૬	ચૈત્ર વદ - ૧ થી ચૈત્ર વદ - ૫	શ્રી સ્વામિનારાયણ બાળયુવા મહોત્સવ	મુ. શ્રી સ્વા. મંદિર - સરધાર, તા. જી. રાજકોટ સંપર્ક :- મો. ૭૬૦૦૦૫૮૫૦૫
૧૪.	૨૮-૪-૨૦૧૬ થી ૬-૫-૨૦૧૬	ચૈત્ર વદ - ૬ થી ચૈત્ર વદ - ૩૦	શ્રી સ્વામિનારાયણ મહોત્સવ	મુ. મોટા ગોંડુડા, તા. સાવરકુડલા, જી. અમરેલી સંપર્ક :- મો. ૮૧૪૧૯૫૮૪૫૮
૧૫.	૭-૫-૨૦૧૬ થી ૧૩-૫-૨૦૧૬	વેશાખ સુદ - ૧ થી વેશાખ સુદ - ૭	પ્રથમ વાર્ષિક પાટોત્સવ	મુ. શ્રી સ્વા. મંદિર - પાદરીયા, તા. જી. ભરુચ સંપર્ક :- મો. ૮૮૨૫૮૨૮૦૨૨, ૮૪૨૮૪૨૭૧૦૦
૧૬.	૧૫-૫-૨૦૧૬ થી ૨૧-૫-૨૦૧૬	વેશાખ સુદ - ૮ થી વેશાખ સુદ - ૧૫	શ્રી સ્વામિનારાયણ મહોત્સવ	મુ. શ્રી કુંજવિલારી વાડી, માંગરોળ રોડ, કેશોદ. સંપર્ક :- મો. ૮૮૭૯૭૦૦૫૦૮
૧૭.	૧૫-૫-૨૦૧૬ થી ૨૧-૫-૨૦૧૬	વેશાખ સુદ - ૮ થી વેશાખ સુદ - ૧૫	વક્તા : પૂ. સ્વામી શ્રી પૂર્ણસ્વરૂપદાસજ્ઞ	મુ. દેવનિકેતન આશ્રમ, લુપ્તવાલા, હરિદાર (ઉત્તરાંદ) સંપર્ક :- મો. ૦૮૭૨૨૭૫૦૫૦૨, ૮૩૨૪૨૪૮૫૦૨

ક્રમ	ગામ	તારીખ	સમય
૧.	ઉમરાળી	૧૬-૧૨-૨૦૧૫	સવારે ૮ થી ૧૨
૨.	સર	૧૬-૧૨-૨૦૧૫	સાંજે ૫ થી ૭
૩.	રાણસીકી	૧૮-૧૨-૨૦૧૫	સાંજે ૫ થી ૭



॥ श्री स्वामिनारायणो विजयतेराम् ॥

वडताल पीठाधिपति प.पू. ध.धु. १००८ श्री आचार्य श्री अजेन्द्रप्रसादज्ञ महाराजशीना  
रुडा आशीर्वांद साह आशाथी जूनागढ श्री राधारमण देवना ताबाना

श्री स्वामिनारायण मंदिर - नाना मुंजुयासरनो

# દૃષ્ટાંજુ મહોત્સવ

ચંતરાંત

## શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ

વક્તા :- પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી - સરધાર

॥ મહોત્સવ પ્રારંભ ॥  
તા. ૧૫-૧૨-૨૦૧૫  
માગશર સુદ - ૮

-: આયોજક :-  
ધર્મકુળ આશ્રિત  
શ્રી સ્વામિનારાયણ મંદિર સત્સંગ સમાજ  
નાના મુંજુયાસર (જૂનાગઢ પ્રેદેશ)

॥ મહોત્સવ પૂર્ણાંહિત ॥  
તા. ૨૫-૧૨-૨૦૧૫  
માગશર સુદ - ૧૫

મહોત્સવ સ્થળ

શ્રી ભીમાબાઈ ઠાકરશીભાઈ તથા નાથાબાઈ પરબ્રતબાઈ સાવલીયાની વાડી  
મુના મુંજુયાસર, તા. ધારસરા, જી. અમરેલી

સંપર્ક - ૯૪૨૪૫૪૫૩૪૮ રોશાંકાઈ સાવલીયા - મો. ૯૮૨૧૩૬૧૦૧૦  
અંગેનાંદી કલાકા - મો. ૯૮૮૯૯૧૧૦૫૫ કલાકાઈ કોણાંદી - મો. ૯૮૮૯૯૧૦૨૯



પદારો જોળ (વડતાલ)

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ধુ. १००८ શ્રી આચાર્ય શ્રી અજેન્ડ્રપ્રસાદજ્ઞ મહારાજશીના  
રુડા આશીર્વાંદ સાહ આશાથી જોળ(વડતાલ)ને આંદાણે

# શ્રીસ્વામિનારાયણો

## મહોત્સવ

ચંતરાંત

### ૧૧ શ્રીમદ્ સત્સંગિજીવન ૧૧

કથા પારાયણ

વક્તા : પૂ.સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

તારીખ : ૩ થી ૧૦ -૧-૨૦૧૬

કથા સમય - સવારે - ૦૮:૩૦ થી ૧૧:૩૦ સાંજે - ૦૩:૦૦ થી ૦૬:૦૦

આયોજક :- ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ - જોળ(વડતાલ) વતી પૂ. ઘનશ્યામ સ્વામી

મહોત્સવ  
સ્થળ

મુન. જોળ (વડતાલ), તા.જી. આણંદ



પૂ. ઘનશ્યામ સ્વામી - ૯૮૨૪૫૩૪૧૦૮, છતુબાઈ - ૯૪૭૮૪૮૮૩૬૮  
યોગેશ પટેલ - ૯૨૨૪૦૦૪૫૬, અર્વિદભાઈ - ૯૮૨૪૩૩૩૪૮

:: તારીખ ::

૬-૧૨-૨૦૧૫

૬૨ મહિનાના પહેલા રવિવારે સરધારધામમાં યોજાતી

## ॥ અભયદાન માસિક સત્સંગ સભા ॥

સ્થળ :- શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર, તા.જી. રાજકોટ. ફો.નં. ૦૨૮૧ - ૨૭૮૧૨૧૧, મો. ૯૮૭૯૫૪૫૦૩

:: સમય ::

સવારે ૮ થી ૧



સ્વામિનારાયણ વિંઠન • નવેમ્બર - ૨૦૧૫



પ.પૂ. ધ.કુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજાથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિનારાયણ શ્રી નૃગેન્દ્રપ્રસાદજીના અધ્યક્ષપટે સુરત શહેરને આંગણે મોટા વરાણી ખાને નૂતન મંદિર ભૂમિ પરિસરાંથી પૂ. સા.ગુ. સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજીના માર્ગદર્શન પ્રમાણે યોજ્યેલ 'દિવ્ય સત્સંગ શિલ્પિ' (તા. ૧૦ થી ૧૭-૧૧-૨૦૧૫)


છપેયાધામ પદ્ધારો...

હેડે હરખ વધારો...

॥ શ્રી સ્વામિનારાયણા વિષ્ણુતરાય ॥

પ.પૂ.ધ.કુ. ૧૦૮ આચાર્ય શ્રી અંજેન્નપ્રસાદજી મહારાજશ્રી તથા

પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિનારાયણ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજાથી...  
સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મ સ્થળ છપેયાધામને આંગણે



# શ્રી છપેયાધામ મહોદ્યાબ



તારીખ



તા. ૨૬-૧૨-૨૦૧૫

રવિવાર થી  
શનિવાર,

માગશર વદ ૧ થી માગશર વદ ૮

પ્રેરક



ઉપાધ્યક્ષશ્રી


પૂ. સ.ગુ. સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી

બગસરા : મો. ૦૯૯૯૯૯૭૨૫૨/૫૫/૬૦ બોટાદા: મો. ૮૨૩૮૩૭૧૬૪૬ સુરત: મો. ૦૯૯૯૯૯૭૨૫૫/૫૭

આયોજક :- શ્રી સ્વામિનારાયણ મંદિર - બગસરા

સ્વામિનારાયણ ચિંતન, નવેમ્બર - ૨૦૧૫ (૨૮)

૨૦મી સત્સંગ છાવણી  
સરદાર



તીર્થધામ સરદારને આંગણે પ.પૂ. ખ.ધુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આશાથી પ. પૂ. ૧૦૮ શ્રી ભાવિયાચાર્ય શ્રી નૃગોદ્બ્રસાદજીના દિવ્ય સાન્નિધ્યમાં  
પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિલયસ્વરૂપદાસજીના માર્ગદર્શન પ્રમાણે યોજાયેલ રૂટની 'શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી' (તા. ૮ થી ૧૭-૧૧-૨૦૧૫)

૧. નૂતન વર્ષના મંગળ પ્રભાતે ઢાકોરજી તથા પ.પૂ. આચાર્ય મહારાજશ્રીનું પૂજનઅર્યન કરી આરતી ઉત્તરાતા પૂ. સ્વામી. ૨. નૂતન વર્ષ પ્રારંભ સભામાં પૂ. સંતો. ૩ થી ૭. પૂ. સંતો-પાર્થી અને હરિભક્તનું પરસ્પર પૂજન દર્શન. ૪. શ્રી સ્વા.મંદિર (જૂન) માં બિરાજમાન ઢાકોરજી સમક્ષ પૂ. સંતો દ્વારા યોગે છૃપનભોગ અનજૂટ. ૮. સંતો-હરિભક્તનો રાસોલ્સવ. ૧૦. સમૂહ આરતી દર્શન.

સ્વામિનારાયણ વિનન, નવેમ્બર - ૨૦૧૫ (૩૦)



તીર્થધામ સરદારને આંગણે પ.પૂ. ધ.ধુ. આચાર્ય મહારાજશ્રીના દૃઢા આશીર્વાદ સહ આશાથી તૈયાર થયેલ નૂતન શ્રી ધનશ્યામ ગોશાળાનું ઉદ્ઘાટન કરતા  
પ.પૂ. ૧૦૮ શ્રી બાવિઅયાર્ય શ્રી નૃગોઙ્પસાદજી સાથે પૂ. સંતો તથા ગોશાળાના મુખ્ય દાતાશ્રી ન્યાલકરણ ચુપ - વડોદરા



૧. સત્સંગ છાવણી દરમ્યાન ચાલતી આંદ ધૂનની પુર્ણાંધૂર્તી કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૨. આ વર્ષથી પોજાયેલ 'બાળ સત્સંગ છાવણી'માં બાળભક્તોને સુસંકરના પાઠી શીખવતા પૂ. સ્વામી. ૩-૪. સંતો-પાર્થદીનો પદ્ધતિમાં પીરસત્તા પ.પૂ. લાલજી મહારાજશ્રી. પ. સત્સંગ છાવણીમાં સંધ્યા આરતીનો લાભ લેતા તમામ પાર્થદી.

પદારો ભાવનગર

પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અચેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના

રડા આશીર્વાદ સહ આજ્ઞાથી

ભાવનગર શહેરને આંગાણે ગટપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું



નૂતન શિખરલદ્ધ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંહિનો...


પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ્દ હર્ટે

# શિખાન્ધ્રાસ

## મહોલ્સાવ

૧૮-૧-૨૦૧૬  
(પોષ સુદ-૬) સોમવાર

LIVE પ્રસારણ



પ્રયોજક તથા વક્તા

એચાયકાશી : પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય  
શ્રી અચેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી - વડતાલ

સર્વોવલાદી ભગવાન શ્રી સ્વામિનારાયણના પુનિત પદાર્થિદી પાવન થથેલ અને એતિહાસિક ગોહિલવાડની ખમીરવંતા શૂરવીરો ની ઘરટી પર વરોલા ભાવનગર શહેરમાં

ઉપાદ્યકાશી : પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય  
શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી - વડતાલ

પૂ.સ.ગુ. સ્વામીશ્રી નિત્યસ્પર્શપાસજી

પ્રારંભ  
૧૧ -૧-૨૦૧૬

પુણ્યકૃતિ  
૧૮ -૧-૨૦૧૬

# શ્રીમદ્ ભરતર્ખંજિણ્યવન

કથા પારાયણ

સ્થળ : માર્કેટીગ ચાર્ડ સામે, ચિત્રા, ભાવનગર

સંપર્ક : કો.પા. અક્ષય ભગત - ૯૦૯૯૯૯૯૬૪૫, પા. સર્વમંગાલ ભગત - ૯૦૯૯૯૯૯૬૩૦